



શ્રીરામ શર્મા આચાર્ય

કોણ છુટ્ટું?

■ શ્રીરામ શર્મા આચાર્ય

તું કોણ તું ?

પોતાના આત્માના સાચા જ્યક્ષપનો
ખ્યાલ આપતું અપૂર્વ પુસ્તક

લેખક:

પં. શ્રીરામ શર્મા આચાર્ય

પ્રાપ્તિ સ્થાન :

યુગનિર્મિત્ર યોજના, મધુરા

શાખા-અમદાવાદ

પાટીધાર સોસાયટી, જીના વાડજ

અમદાવાદ-૩૬૦૦૧૩

ફોન- (079) 2755725

૨૦૦૬

કિલો રૂ. ૫.૦૦

પ્રસ્તાવના

આ સંસારમાં જાગુવા જેવી ઘણી વાતો છે. વિદ્યાનાં અનેક ક્ષેત્રો છે, સંરોધન માટે, મહિની મેળવવા માટે ઘણું રસ્તા છે. વિજ્ઞાનનાં એવાં કેટલાયે પાસાં છે જે જાગુવાં મનુષ્ય માટે જરૂરી છે. શા માટે ? ડેવી રીત ? ઝ્યાં ? ક્યારે ?આ પ્રેર્ણો દેખક ક્ષેત્રમાં માનવીએ ફેરફારી છે. આ જિજ્ઞાસુવૃત્તિને લીધે જ માનવીએ અત્યાર સુધી આટલું બધું જ્ઞાન મેળખ્યું છે અને સાધન સંપન્ન બન્યો છે. સાચે જ જ્ઞાન એ જીવનની દીવાદાંડી છે.

જાગુકારીની ઘણી વાતોમાંથી “પોતાની જાતની જાગુકારી” સર્વત્રેષ્ઠ છે. આપણે દુનિયાની અનેક વાતો જાણીએ છીએ અથવા જાગુવા પ્રયત્ન કરીએ છીએ પણ આપણે એ તો ભૂલી જ જઈએ છીએ કે આપણે પોતે શું છીએ ? પોતાની જાતને જાણ્યા વિના જીવન ડામાણેળ, અનિશ્ચિત અને કાંટાળું બની જાય છે. પોતાની વાસ્તવિક જાગુકારી ન હોવાથી માગુસ ન વિચારવા જેવી વાતો વિચારે છે અને ન કરવા જેવાં ફૂલ્યો કરે છે. સાચા સુખ અને સાચી શક્તિનો રાજમાર્ગ એક જ છે અને તે છે ; આત્મજ્ઞાન.

આ પુસ્તકમાં આત્મ જ્ઞાનની સમજ આપવામાં આવી છે. “હું કોણ દું ?” આ પ્રેર્ણનો જવાબ શબ્દોથી નહીં, પણ સાધના દ્વારા છદ્યંગમ કરવવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કર્યો છે. આ પુસ્તક અધ્યાત્મ માર્ગના વટેમાર્ગુઓને ઉપયોગી રસ્તો ચીધશે એવી મને આશા છે.

- શ્રીરામ શર્મા આચાર્ય

પહેલો અધ્યાય—આત્મબોધ

હું કોણ દું ? મારી શક્તિ સું છે ? હું કોણ દું ? મારું સું કર્ત્વ છે ?.....વગેરે વાતોનો બરાબર વિચાર કરો. બધા તત્ત્વદર્શાઓએ જ્ઞાનનું એક જ સ્વરૂપ બનાવ્યું છે અને તે છે “આત્મ બોધ”. પોતાના સંબંધમાં પૂરી જ્ઞાનકારી મેળવી લીધા પછી આ સંસારમાં કઈ જ્ઞાનવા જેવું બાકી રહેતું જ નથી. જ્ઞાવ હીક્રે ઈંધ્રવર જ છે. વિચારેથી બંધાઈ તે વિકૃત સ્વરૂપે દેખાય છે, પણ તેના અંતરાળમાં તો અમૂલ્ય ખજાનો ધૂપાયેલો છે. શક્તિનું એ કેન્દ્ર છે અને તે એટલું સંસ્કૃતમ છે કે આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ. આ દુનિયાનાં બધાં દુઃખોનું ભૂણ એ છે કે આપણે પોતાની જ્ઞાતને જ્ઞાનતાં નથી. જ્યારે આત્માની ઓળખાણ પાકી થાય છે, ત્યારે કોઈ દુઃખ રહેતું નથી. આત્માની ઓળખાણ મેળવી લીધા પછી તે ક્રેદિત : હું ઉત્સુક થયો જ નથી પછી મારે જીનું અને મોત કેવાં ? હું મન નથી તો પછી મને શોક અને મોહ રોના ? હું જ કર્તા દું પછી મારે બંધન અને મોકા કેવાં ?

જ્યારે તે જ્ઞાની જ્ઞાય છે કે “હું કોણ દું ?” ત્યારે તેને વાસ્તવિક જ્ઞાન થાય છે અને બધી વસ્તુઓને સાચા સ્વરૂપે જોઈ તેનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. કોઈ પણ દૈષ્ઠિદ્યોગથી વિચારીએ, આત્મજ્ઞાન જ સર્વસુલભ અને સર્વોચ્ચ જ્ઞાન છે.

કોઈ વ્યક્તિને એમ પૂર્ણામાં આવે કે “આપ કોણ છો ?” એટલે તત્ત્વ એ વ્યક્તિ પોતાની જ્ઞાતિ, કુળ, ધંધો, હોદ્દો કે સંપ્રદાયનો પરિય્ય આપી દેશે. “હું બ્રાહ્મણ દું, પટેલ દું, ઠકોર દું, વૈષ્ણવ દું, જમીનદાર દું, વેપારી દું”.....વગેરે જ્વાબ આપશો. વધુ પૂર્ણાંતે પોતાનાં નામ ઠામ વગેરે વિગતોની ઊડાજથી માહિતી આપશો. પ્રશ્ન પૂર્ણથો એટલે આવો જ્વાબ મળ્યો એવું નથી. હીક્રે જ્વાબ આપનાર પોતાની જ્ઞાતને એ રીતનો જ માને છે. શરીર ભાવમાં માનવી એટલો તલ્લીન થઈ ગયો છે કે, તે પોતાની જ્ઞાતને શરીર જ માની બઢે છે.

વંશ, વર્ગ, ધંધો કે હોદ્દો શરીરનો હોય છે. શરીર એ માનવીનું વસ્તુ અધ્યવા હું કોણ દું ?

હુથિયાર છે પણ ભ્રમ અને અજ્ઞાનને લીધે માનવી પોતાને શરીર જ માને છે અને શરીરના સ્વાર્થ પોતાના સ્વાર્થ માની લે છે. આ ગૂંઘવળભાં જ જીવન અનેક અસાંતિ, ચિંતા અને અધિદ્વાધિ, ઉપાધિઓનું ઘર બની જાય છે.

માનવી શરીરમાં ખે છે એ સાચું છે, પણ શરીર એ માનવી નથી એ પણ એટલું જ સાચું છે. જીવનના અંતકાળે જ્યારે પ્રાગું નીકળી જાય છે, ત્યારે શરીર જેમનું તેમ પડી ખે છે. તેમાં ક્રોઈ વસ્તુ ખૂટની ન હેવા છાં ખૂન શરીર બેકાર બની જાય છે. થોડે સમય રહેવા દેતાં લાશ સર્વા લાગે છે, દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને જીવાત પડી જાય છે. શરીર તેનું તે જ છે. જ્યાંનું ત્યાં જ છે છાં પ્રાગું નીકળી જતાં તેની આવી દુર્શા થાય છે. આ સાંબિન કરે છેકે માનવી શરીરમાં નિવાસ તો કરે જ છે, પણ હીક્કે તે શરીરથી જુદ્યે છે. આ જુદા અસ્તિત્વને “આત્મા” કહે છે. હીક્કે તે જ મનુષ્ય છે. હું પ્રોગું દું ? નો સાચો જ્યાબ એ છે કે “હું આત્મા દું.”

શરીર અને આત્માના ભેદની વાતો આપણે બધાં સાંભળીએ છીએ, તેને માનીએ છીએ. ક્ષાય ક્રોઈ એવો વિરોધ કરેકે શરીરથી જીવ જુદ્યે નથી. આપણે સૈદ્ધાંતિક રીતે તો માનીએ છીએ કે જીવ અને શરીર અલગ અલગ છે, પણ વ્યવહારમાં આપણે તેમ કસાં નથી. પોતે જ શરીર છે એવો વ્યવહાર બધાં કસાં હોય છે. શરીરને થયેલ નુકસાન પોતાનું નુકસાન માની લે છે અને તેને થયેલો લાભ પોતાને થયો છે તેમ માને છે. ક્રોઈ વ્યક્તિને જીણવટથી જોઈએ અને નોંધીએ કે તે શું વિચારે છે ? શું કહે છે ? શું કરે છે ?તો ખબર પડ્યો કે તે પોતાના શરીર સંબંધે જ વિચારે છે. એને લગતી જ વાતો કરે છે અને પોતાના શરીરને કેન્દ્રમાં રાખી કામ કરે છે, એણે શરીરને જ “હું” માની લીધું છે.

શરીર આત્માનું મંહિર છે. તેની સ્વસ્થતા, સ્વચ્છતા અને સગવડો માટે કામ કરવું જરૂરી છે. છાં આપણા શરીર માટે જ વિચારીએ, એને આપણું રૂપ માની લઈએ અને આપણા વાસ્તવિક રૂપને ભૂલી જઈએ એ જોટું છે. પોતાની જાતને શરીર માની લેતાં શરીરને થતાં લાભ-નુકસાન પોતાના માની લઈએ છીએ અને વાસ્તવિક જીને ભૂલી જઈએ છીએ. આ ભુલ-ભુલામણીનો ખેલ

જીવનને તેર જેવું બનાવી દે છે.

આત્મા શરીરથી અલગ છે. શરીર અને આત્માના સ્વાર્થ પણ અલગ અલગ છે. શરીરના સ્વાર્થોનું પ્રતિનિધિત્વ ઈન્ડ્રિયો કરે છે. દ્વા ઈન્ડ્રિયો અને અગિયારમું મન આ બધાં શરીરને ઝેન્ડમાં રાખીને જ વિચારે છે અને કામ કરે છે. સ્વાદિષ્ટ ભોજન, સુંદર ડપડા, સુંદર મનોહર દ્રશ્ય, મધુર સંગીત, સ્વરૂપવાન પણી એવા કેટલાય પ્રકાસન ભોગ-વિલાસ એ ઈન્ડ્રિયોની આકંક્ષાઓ હોય છે. ઊંચું પદ, હોદ્દો, અઢળક ધન સંપત્તિ, દૂર દૂર સુધી પ્રતિષ્ઠા, ઠાઠ-માઠ આ બધી મનની આકંક્ષાઓ છે. આ બધી ઈચ્છાઓ સંતોષવામાં જ સમગ્ર જીવન ખર્યાઈ જાય છે. જથ્યારે આ ઈચ્છાઓ તીવ્ર બને છે, ત્યારે માનવી કોઈ પણ ભોગ તે સંતોષવાનું નક્કી કરે છે. સારા નરસાનો ભેદ, વિવેક, બુદ્ધિ ગુમાવી બેસે છે અને કોઈ પણ ભોગે સ્વાર્થ સાધે છે. બધાં પાપોનું મૂળ ઝેન્ડલિંગ્ઝ જ આ છે.

શરીર ભાવમાં જીગૃત રહેતો માનવી જો અનાજ, ઊંઘ, ભય અને મૈથુનનાં સામાન્ય કાર્યોમાં રચ્યો રહે તો તે પણ જેવું જીવન જીવવાનો કાંઈ અર્થ નથી. એમાંય જો તેની ઈચ્છાઓ થોડી તીવ્ર બને, તે ઉત્સુક બને તો તે માનવ-પણ નહીં; પરંતુ શયતાન બની જાય છે. અનીતિપૂર્વક સ્વાર્થ સાધવામાં તે સહેજેય ખયકાતો નથી, ડરતો નથી. આ રીતે વ્યક્તિ જાતે સુખી રહી રક્ષકો નથી અને બીજાને સુખેથી રહેવા દેતો નથી. કામ અને લોભ એવા તત્ત્વ છે કે તેને કેટલાય ભોગ આપે, છાં તે અતૃપણ જ રહે છે. જેટલું ભોગવે છે એટલી જ તૃષ્ણાની સાથોસાથ અસાંતિ, ચિંતા, કામના અને વ્યકૃતાતા વધા કરે છે. આ ભોગોમાં જે સુખ મળે છે તેનાથી અનેકગાળું દુઃખ મળે છે અને આગળ જતાં પાપ, તાપ, તૃષ્ણા, અસાંતિ તરફ માનવીને ફસડી જાય છે.

જીવનની વાસ્તવિક સફળતા અને સમૃદ્ધિ આત્મભાવમાં જીગૃત સહેવામાં છે. જથ્યારે માનવી પોતાને આત્મા માને છે ત્યારે તેની ઈચ્છા, આકંક્ષા અને લગ્ન જે કાર્યોથી આધ્યાત્મિક સુખ મળે છે તેવાં કાર્યો પૂર્યે જાગે છે. આપણે જોઈએ છીએ કે ચોરી, હિસા, વલિયાર, છાણકપટકે અનીતિબર્યા પગલાં ભરતાં અંતકરણમાં જે એક પ્રકાસ્તો ખળભળાટ મરી જાય છે, પાપ કરતાં પગ પૂછે

છે અને હૃદયની ધડકણો વધી જાય છે. આનો અર્થ એ થાય છે કે આવાં કૃષ્ણને આપણો આત્મા પસંદ કરતો નથી. આવાં કૃષ્ણ આત્માના સ્વાર્થ અને ઉક્કર્ણની વિરુદ્ધનાં છે, પણ જ્યારે માનવી પરોપકાર, પરમાર્થ, સેવા, મહૂદ, દાન, ઉકારતા, ત્યાગ, તપથી ભરેલાં પુરુષકાર્ય કરે છે. ત્યારે હૃદયનાં એક ખૂબામાં ખૂલ જ સંતોષ, હળવારાં શાંતિ, આનંદ અને ઉક્કાસ થાય છે. આનો અર્થ એ થાય છે કે આવાં પુરુષકર્મ આત્માના સ્વાર્થનાં છે. આત્માના ઉક્કર્ણ માટેનાં છે અને આત્મા આવાં જ કાર્યો પસંદ કરે છે. આત્માનો અવાજ સાંભળનાર અને તે પ્રમાણે ચાલનાર હંમેશાં પુરુષકર્મ કરનારાં હોય છે. પાપ તરફ તેઓની પ્રવૃત્તિ હોતી નથી અને નેથી જ તેઓ નીચ કાર્ય કરતાં પણ નથી.

આત્માને તત્કાળ સુખ સંતકર્મોમાં મળે છે. શરીરનું મૃત્યુ થયા બાદ જીવને સદ્ગતિ મળે તે હેતુસર કરેલાં કાર્ય સંકર્મ જ હોય છે. આલોક અને પરલોકમાં આત્મિક સુખશાંતિ સત્કર્મો પર જ આધારિત છે. આ માટે આત્માનો સ્વાર્થ પુરુષ કાર્યોમાં હોય છે. શરીરનો સ્વાર્થ નેનથી વિરુદ્ધ છે. ઈન્દ્રિયો અને મન સંસારના ભોગ વધુને વધુ ભોગવવા ચાહે છે. આ કાર્યપ્રણાલી અપનાવવાથી માનવી નાશવંત શરીરની ઈચ્છાઓ પૂરી કરવામાં જ પોતાનું જીવન ખર્ચી નાજે છે અને પાપનાં પોટલાં બાંધ્યે રાજે છે. આનાથી શરીર અને મનને આનંદ તો આવે જ છે પણ આત્માએ આલોક અને પરલોકમાં યાતનાઓ જ ભોગવવી પડે છે. આત્માના સ્વાર્થનાં કાર્યોમાં શરીર પાગ દુઃખ, કષ્ટ ભોગવવાં પડે છે. તપ, ત્યાગ, સંયમ, બ્રહ્મયર્થ, સેવા, દાન વગેરે કાર્યોથી શરીરની કષ્ક પરીક્ષા થાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે શરીરનો સ્વાર્થ અને આત્માનો સ્વાર્થ તદ્દન વિરોધી છે. એ બે વચ્ચે મેળ ખાતો નથી. એકનું દુઃખ બીજાનું સુખ બની રહે છે.

આ બે પરસ્પર વિરોધી તત્ત્વોમાંથી આપણે એક પર પસંદગીનો કાળ દેણવાનો છે. જે વ્યક્તિ પોતાને શરીર સમજે છે તે આત્માના સુખની પરવા કર્સો નથી અને શરીર સુખ માટે ભૌતિક સંપત્તિ, ભોગ સામગ્રી એક્ટી કરવામાં આખું જીવન વેક્ઝી નાજે છે. આવા લોકોનું જીવન પરશુરંતું પાપદુપ અને નીચ કલાનું હોય છે. ધર્મ, ઈશ્વર, સદ્ગ્યાર, પરલોક, પુરુષ, પરમાર્થની

યર્થી તેઓ ભલે કરે પાગ હીકુતે તેઓનું પુણ્ય અને પરલોક તેમના અંગત સ્વાર્થમાં જ હોય છે. પ્રતિજ્ઞા માટે પોતાનું અભિમાન સત્તોપવા, બીજા પર ધાક જમાપવા તેઓ ક્યારેક ધર્મનો આશરો વે છે. આમ તો તેમનું મન સદાય શરીર સ્વાર્થનાં સાધનોમાં જ લાગેલું હોય છે, પાગ જ્યારે મનુષ્ય આત્માના સ્વાર્થની સ્વીકારે છે ત્યારે તેની પરિસ્થિતિ સમૂહળાણી પલટાઈ જાય છે. ભોગ અને એશાચારામ એને બાળકેની રમત જેવાં લાગે છે. શરીર જે હીકુતે આત્માનું વસ્ત કે હથિયાર છે તેવા બહુમૂલ્ય જીવનને તે બરબાદ કરવા તૈયાર થતો નથી. આત્મભાવમાં જાગૃત માનવી પોતાની જતને આત્મા માને છે અને કલ્યાણનાં, આત્મ સુખનાં કર્યોમાં જ તેને રસ પડે છે અને તેવાં કર્યોમાં જ તે પ્રયત્નશીલ રહે છે. તેને આવાં પુણ્યકર્યોમાં પોતાના સમયની એક એક ઘડી લગાડી દેવાની તમના રહે છે. આ રીતે શરીરભાવમાં જાગૃત, માનવીનું જીવન પાપ, પશુતાં, તરફ ઢસડાય છે, જ્યારે આત્મભાવમાં જાગૃત માનવીનું જીવન પુણ્ય તરફ, દેવત્વ તરફ ઢસડાય છે. બધા જાણે છેકે આલોક અને પરલોકમાં પાપનું પરિણામ દુઃખના રૂપમાં જ અને પુણ્યનું પરિણામ સુખના રૂપમાં જ ભોગપવાનું હોય છે. પોતાને આત્મા સમજનાર માનવી સદા પરમાનંદની સ્થિતિનો રસાસ્વાદ માણનો રહે છે.

જેને આત્મજ્ઞાન થઈ જાય છે, તે નાની મોટી ઘટનાઓથી અપ્રભાવિત રહે છે એવા બનાવોથી તે ઉત્તેજિત થતો નથી કે વિહૃવળ પાગ થતો નથી. લાભ, નુક્સાન, જીવન, મરણ, વિસ્ફાર-વેદના, માન, અપમાન, લોક, કામ, બ્રેધ, ભોગ, રાગ, દ્રેષના કોઈ પાગ બનાવ તેને વિચારિત કરી શકતા નથી, કારણ કે તે જાણે છેકે આ બધા બનાવો પરિવર્તનશીલ સંસારમાં રોજના બન્યા કરે છે. મનોવાચિકાન વસ્તુ કે પરિસ્થિતિ સદા પ્રાપ્ત થતી નથી. કાળયક્ણા પરિવર્તન સાથે સાથે અનિચ્છિક ઘટનાઓ પાગ બન્યા કરે છે. તેથી આવાં પરિવર્તનોને, આવા બનાવોને, એક મનોરંજનની જેમ, નાટકના રંગ-મંચની જેમ, કુલૂષલ અને છળવાશથી મૂલવવી જોઈએ. આત્મજ્ઞાની કોઈ અજ્ઞાતી ઘટના બનતાં બેચેન થતો નથી. તે આવા માનસિક સંકટોથી સહેજેય બચી જાય છે, જ્યારે આવા જ પ્રસંગોએ શરીરભાવી માનવી સદા વ્યથિત અને બેચેન રહે છે, ક્યારેક ઉત્તેજિત

થઈ આત્મજ્ઞયા જેવાં પગલાં પણ ભરે છે.

જીવનને શુદ્ધ સરળ, સ્વામાયિક તેમ જ પુસ્ય પ્રતિષ્ઠાથી ભરપૂર બનાવવાનો એક જ રાજમાર્ગ છે કે આપણે આપણા શરીરભાવમાંથી જાય ઉઠીએ અને આત્મભાવમાં જાગૃત થઈએ. તેનાથી સાચું સુખ, રાંતિ અને જીવન લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મવિદ્યાના તત્ત્વચિંતકોએ આ તથનો ખૂબ અનુભવ કરેલો છે અને તેથી પોતાની સાધનામાં પ્રથમ સ્થાન આત્મજ્ઞાનને આપેલું છે. હું કોણ છું ? આ પ્રેરણ પર વિચાર કરતાં કહું એક જ જ્વાબ મળે છે કે હું આત્મા છું. આ ભાવ જેટલો દેઢ હોય તેટલા જ તેના વિચારે અને કાર્ય આધ્યાત્મિક અને પુસ્યસાળી બનતાં જાય છે. આ પુસ્તકમાં એવી જ સાધનાઓ બતાવેલી છે, જે દ્વારા આપણે પોતાના આત્મવૃપને ઓળખીએ અને હૃદ્યમાં કંડારી લઈએ. આત્મજ્ઞાન થતાં એ સાચો માર્ગ મળે છે. જેના પર ચાલી આપણે જીવન લક્ષ્યને, પરમ પદને સહેલાઈથી મેળવી શકીએ છીએ.

આત્મા સ્વરૂપને ઓળખવાથી મનુષ્ય જાણી જાય છે કે હું સ્થૂળ અથવ સૂક્ષ્મ શરીર નથી, આ મારાં કપડા છે. મનની ઈચ્છાઓ, એની ચેતના એ મારાં ઓજારો છે. તે મારું બંધન નથી. હું તે બધાંથી બંધાયેલો નથી. સાચી હકીક્તી સમજાવતાં જ બધો ભ્રમ ભાંગી જાય છે અને વાંદરો મુઢીમાંનું અનાજ છેડી હે છે. આપે એ વાત સાંભળી હોય કે એક સંક્રાંતો મૌંવાળા ઘડામાં અનાજ ભર્યું હું. વાંદરાએ તે અનાજ લેવા ઘડામાં હાથ નાંખ્યો અને મુઢી ભરી તે અનાજ કાઢવા લાગ્યો. સંક્રાંતો મૌંવે લીધે હાથ ઘડામાં ભરાઈ ગયો અને બિચારે વાંદરો ચીસો પાડ્યો રહ્યો કે “અનાજે મારો હાથ પકડી રાખ્યો છે, મને છોડાવો.” પણ જેવી તેને ખબર પડી કે મે જ મુઢીમાં અનાજ પકડી રાખ્યું છે એટલે મુઢી ખોલ્યી કે તસ્ત જ અનાજે વાંદરાનો હાથ છોડી દીધો. કામ, ઝોથ, વગેરે આપણને એટલા માટે સતતે છે, કારણ કે આપણે તેમની ગુલામી સ્વીકારી લીધી છે. જે દિવસે આપણે તેની સામે બંડ પેકારીશું તે જ દિવસે ભ્રમ ભાંગી જરો. ઘેટાં સાથે ઊછસું સિંહનું બરચું પોતાને પણ ઘેટું જ સમજતું હું. જ્યારે તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંబ જોયું, ત્યારે તેને ખબર પડી કે હું ઘેટું નથી, પણ સિંહ છું. આત્મસ્વરૂપનું ભાન થતાં જ તેનું ઘેટાપાણું તાત્કાલિક

દૂર થઈ ગયું. આત્મર્દ્દનની મહત્વા કંઈક આવી જ છે. જોગે તે જાણી લીધું એણે પોતે જેનાથી હરસંમેશ પીડાનો હતો તે બધા દુઃખ દાર્દીથી દુષ્કરો મેળવી લીધો.

જાણવા યોગ્ય આ સંસારમાં અનેક વસ્તુઓ છે, પાણ એ બધામાં મુખ્ય, પોતાની જાતને જાણવી તે છે. જોગે પોતાને જાણી લીધો એણે છુંનનું રહસ્ય સમજી લીધું છે. ભૌતિક વિજ્ઞાનના સંશોધકોએ અનેક આશ્રયજનક સંશોધનો કર્યા છે. કુલસના અંતરાળમાં ધૂપાયેલી વિદ્યુત રાજીનિ, ઈંધર રાજીનિ, પરમાણુ રાજીનિ વગેરે શોધી કાઢ્યાં છે. અધ્યાત્મ જગતના મહાન સંશોધકોએ છુંનસિધુનું મંધન કરી આત્માની અમૃત મેળવી લીધું છે. આ આત્માને જાણનાર સાચો જ્ઞાની બની જાય છે અને તે જ્ઞાન પ્રાપ્ત કરનાર વિશ્વવિજ્ઞાની, માયાતીત ક્ષેવાય છે. દેખ વજિનું કર્યા છે કે તે પોતાને જાણે. હું કોણ હું ? એ પ્રેરણ પોતાની જાતને પૂછે અને વિચાર, મનન, ચિંતનપૂર્વક એનો સાચો અર્થ મેળવે. પોતાનું સાચું રૂપ ખબર પડવાથી આપણે પોતાનાં વાસ્તવિક હિત-અહિત સમજી શકીએ છીએ. વિષયાનુરાગી સ્થિતિમાં છું જે વાતોમાં લાભ જૂએ છે, તેના માટે લલચાય છે. આજ લાભને, આત્માનો અનુરાગી તુચ્છ માને છે. નુકસાનકારક માને છે. માયામાં રચનો છું જે વાતોથી દૂર ભાગે છે તેમાં આત્મપરાયાનો રસ વધતો જાય છે. આત્મ સાધનાના રાજમાર્ગનો પણિક પોતાની અંદરની આંખો ખોલી રહે છે અને તે છુંનમાં મહત્વપૂર્ણ રહસ્યો સમજી શક્યવત સત્ય તરફ પૂરા જોસા અને ઉમગથી જડપી ક્રમ માંડો ચાલ્યો જાય છે.

અનેક સાધકો અધ્યાત્મપથ પર વધુવાનો પ્રયત્ન તો કરે છે, પાણ તેમને ક્રમ અધૂરી સાધના જ શીખવવામાં આવે છે. મનુષ્ય પોતાને સાચી રીતે ઓળખે તો જ તેની ખુમારી ઊતરી રહે. જે ઈલાજ માત્ર હાથ પગ હલાવવા બંધ કરે કે આંખો ઠીક થઈ જાય તે ઈલાજ સંપૂર્ણ નથી. યજ્ઞ, તપ, દાન, પ્રત, અનુષ્ઠાન, જ્યોતિર સાધનાઓ લાભદાયી છે. એની જરૂર વિષે પાણ કોઈ રંકા નથી, છાં તે માત્ર પૂર્ણ નથી. તેનાથી પવિત્રતા વધે છે, સદગુણ વધે છે, પુરુષ વધે છે પાણ એ ચૈતના મળતી નથી. જે દ્વારા બધા પદાર્થોનું વાસ્તવિક રૂપ ખબર પડે અને બધો ભ્રમ ભાંગી જાય. આ પુસ્તકમાં માર્યે ઉદ્દિષ્ટ

સાધકને આત્મજ્ઞાનની ચેતના માટે જગૃત કરવાનો છે, કારણ કે હું માનું દ્વિ
કે મુજિ માટે આનાથી સારો, સહેલો અને ચોક્કસ રસ્તો ક્રેઈ છેઈ શકે જ નહીં.
જેણે આત્મ સ્વરૂપનો અનુભવ કરી લીધો, સદગુરો તેના દાસ બની જાય છે
અને દુર્ગુરો કર્યાં ચાલ્યા જાય છે તે ખબર પાગ પડી નથી.

આત્મજ્ઞાનનું આ અનુષ્ઠાન સાધકને ઊચે ઉઠાવશે. આ ઊચા શિખરે
પહોંચી તે જોરો કે દુનિયા ડેટલી વિશાળ છે. મારો પ્રભાવ ઘણું વધારે છે,
મારું રાજ્ય વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જેટલી ચિંતા અત્યાર સુધી હીં
તેનાથી અનેકગુંગી વધુ ચિંતા હેઠે મારે કર્યાની છે. હું પહેલાં જે વસ્તુઓ ને
જોતો હતો તેનાથી ધારી વધારે વસ્તુઓ મારી છે. હેઠે સાધક વધુ ઊચા
શિખરે ચેઢે છે અને અનુભવે છે કે મારી પાસે હજુ આનાથી વધારે સંપત્તિ
તો નથી ને ? જેમ જેમ તે ઊચે જાય છે. તેમ તેમ પોતાની વસ્તુઓ વધુને
વધુ અનુભવે છે. અંતે તે સર્વોચ્ચ શિખરે પહોંચી સમગ્ર વિશ્વમાં બધી જ
ચીજ -વસ્તુઓ પોતાની જ અનુભવશે. અત્યાર સુધી તેને એક બહેન, બે
ભાઈ, મા-બાપ, બે ઘોડા, દ્રા નોકદેના પાલનની ચિંતા હીં. હવે તેને હજાર
ગારાં પ્રાણીઓના પાલનની ચિંતા થાય છે. આ અહમુભાવનો વિસ્તાર છે. બીજા
તત્વજ્ઞાનીઓ અને જ અહુમ ભાવનો નારા કહે છે વાત એક જ છે ઇક્ક માત્ર
કહેવા સાંભળવામાં છે. રૂખરના કુગ્ગામાં હવા ભરી રમતાં બાળકો તો તમે
જોયાં હરો એમાંથી એકાદ કુગ્ગો લઈ હવા ભરો, જેટલી હવા ભસ્તા જશો તેટલો
તે કુગ્ગો મોટો થતો જરો અને ફાટ્યાની તેયારીમાં આવી જરો. થોડી વરમાં
હવા વધુ ભરાતાં તે કુગ્ગાને તોડી પોતાના વિશાટ્ય આકારમાં ભરેલાં મહાન
વાયુતત્વમાં મળી જરો...આત્મજ્ઞાનની આ જ પ્રાણાલી છે. આ પુસ્તક તમને
જ્ઞાનવિજ્ઞાન દ્ધૂપાયેલું છે. જેના આધારે અધ્યાત્મના અલગ અલગ માર્ગો
બનાવેલા છે. ક્રેઈપણ પ્રકારની સારી સાધનાથી ક્રેઈ પાગ જગ્યાએ, ક્રેઈ પાગ
શીતે પ્રાણ થતાં ફળનું એ બીજ છે.

આત્માના વાસ્તવિક રૂપને એકાર જોઈ લેનાર સાધક પછી પાછો નથી
કસ્તો. પાણીની તરસથી બાકુણ માનવી, જેનો જીવ પાણી માટે તરફાયાં

હું બેણ હું ?

મારતો હોય. તેવો માનવી સરોવરનું શીતળ જળ છેડી શું ફરીવાર વેરાન રણમાં આવવાની ઈચ્છા કરે ? ભગવાન કહે છે : જ્યાં જઈને પાછું આવવાનું નથી એ મારું ધામ છે. સાચે જ ત્યાં પહોંચાં પછી ડગલું પાછું પડ્યું જ નથી. યોગબ્રદ્ધ થવાનો ત્યાં પ્રત્યે જ નથી. ધેર પહોંચાં પછી શું કોઈ વ્યક્તિ ધેર જવાનો રસ્તો ભૂલી રહે ?

કામ, કોષ્ટ, લોભ, મોષ્ટ, વગેરે વિકારો અને ઈન્ડિયોની વાસના મનુષ્યના આનંદમાં બાધ્ય બની તેને દુઃખમાં નાખી દે છે. પાપ અને બંધનનું આ મૂળ છે. પતન આના વડે જ થાય છે અને ઇમ્રાણ : જીવ અધોગતિ તરફ ટ્રસ્ટાય છે. જુદા જુદા અધ્યાત્મ માર્ગની વિરાટ સાધનાઓ આ દુષ્ટ રાત્રુંથોને હરાવવાના ચક્કાયૂહ સમાન છે. અર્જુનનુંપી મનને આ મહાભાસ્તમાં પ્રવૃત્ત થવા ભગવાન લલકરે છે.

આ પુસ્તકનાં આગલાં અધ્યાયોમાં આત્મદર્શન માટે જે સરળ સાધનાઓ બતાવી છે તે કરવાથી આપણે સાંસારિક પ્રવૃત્તિઓ ન પહોંચી શકે એવા સ્થળ સુધી ઊચે ઊડી શકીએ છીએ. જ્યારે દુર્ગાશો રહેશે નહીં ત્યારે જે રહેશે તે માત્ર સદગુણો જ હો. આમ આત્મદર્શનનું સ્વાભાવિક ઇણ દૈવી સંપદા પ્રાપ્ત કરવાનું છે. આત્મ સ્વરૂપનો અહુમ ભાવનો વધુને વધુ વિસ્તાર થતાં રબ્બરના કુંગાની જેમ બંધન તૂટી જશે અને આત્મા પરમાત્મામાં મળી જશે. આ ભાવાર્થ જાણું ધરું સાધક નિરસા થશે. અને કહેશે કે આ તો સંન્યાસીઓનો રસ્તો છે. જેઓ ઈશ્વરમાં લીન થવા માગે છે અથવા પરમાર્થ સાધના કરવા માગે છે, તેઓના માટે આ સાધનાઓ ઉપયોગી છે. આનો લાભ પારલોક્ષિક છે, પણ આપણા જીવનનો બધો કાર્યક્રમ ઈહલોક્ષિક છે. આપણો દૈનિક કાર્યક્રમ ધંધો, નોકરી, જ્ઞાન મેળવવું, ધન મેળવવું, મનોરંજન વગેરે છે. આ બધું આપણે થોડા સમય માટે પારલોક્ષિક કાર્યો માટે કાળવી શકીએ છીએ, પરંતુ આપણી મોટાભાગની જીવન ચર્ચા સાંસારિક કામોમાં જ લાગેલી હોય છે એટલે આપણા અધિકાંત્ર જીવનના કાર્યક્રમોમાં આનો રો લાભ ઊઠ્યો શકીએ ?

ઉપરોક્ત શંકા સ્વાભાવિક છે, કારણ કે આપણી વિચારધારા અત્યારે એવી ગુંઘવાઈ ગઈ છે કે લોક્ષિક અને પારલોક્ષિક સ્વાર્થોના બે ભાગ પાડવા પડે છે.

વાસ્તવમાં એવા કોઈ ભાગ પાડવાની જરૂર જ નથી, જે લૌકિક છે તે જ પારલૌકિક છે. બને એક જ સિક્કાની બે બાજુની જેમ જોડાયેલા છે, પેટ અને પીઠની જેમ જોડાયેલા છે. આમ ઇંાં હું તમારી સંપૂર્ણ વિચારધારાને ઉલટાવી નામવા માગતો નથી. અહીં તો એટલું જ કહેવું વાજબી માનું હું કે આત્મર્દ્દન વ્યાવહારિક છુપનને સુશીળ બનાવવાનો સર્વફ્રેઝ માર્ગ છે. આત્મોનાત્મ સાથે જ સાંસારિક ઉનતિ જોડાયેલી છે જેની પાસે આત્મબળ છે અની પાસે બધું જ છે અને તમામ પ્રકારની સફળતા તેનાં કષ્મો ચૂભ્યા કરશે.

વ્યક્તિ પોતાના આત્મસ્વરૂપને ઓળખે, પોતાના ગૌરવને જાગે, પોતાના હક્કો શોધે અને પોતાના પરમપિતાની અમૃત્ય સંપત્તિના વારસા માટે પોતાનો દાવો નોંધાવે. યોગનું આ સ્વાભાવિક અને સાધારણ રહસ્ય છે. સીધો, સાધી, સાચ્યો અને વગર નુકસાનનો આ માર્ગ છે. આ મહાન વાત દરેકના ઘ્યાલમાં આવવી જોઈએ કે પોતાની શક્તિ અને પોતાના હથિયારોની જાગુકારી કોઈ પણ કુર્યાની સફળતા માટે અન્યાન્ય આવશ્યક છે, કારણ કે ઉત્તમમાં ઉત્તમ બુદ્ધિશાળી પણ આ જાગુનો નથી. ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકતો નથી.

અધ્યાત્મ શાસ્ત્ર કહે છે. ઓ અવિનારી આત્માઓ ! તમે તુછુ નહીં પણ મહાન છો ! તમારે ભીખ માગવાની જરૂર નથી, તમે બીજું, નમાલા પણ નથી. તમે અનંત શક્તિશાળી છો. તમારે બળની ચિંતા કરવાની જરૂર નથી. જે સાધનો લઈ તમે અવતર્યા છો તે બધાં અચૂક બ્રહ્માસ્તો છે. તેની શક્તિ અનેક ઈન્ડ્રાવજ્ઞ કર્તાં ય વિરાટ છે. સફળતા અને આનંદ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. ઉઠો ! પોતાને પોતાના હથિયારોને અને કર્ણબ્યોને સાચી રીતે સમજી લો, ઓળખી લો અને બુદ્ધિપૂર્વક જોડાઈ જાવ. પછી જુઓ કે તમારે જે જોઈએ છે એ તે તમને મળે છે કે નહીં ? તમે કટ્પવૃક્ષ છો, કામધેનુ છો અને સફળતાની સાક્ષાત્ મુર્તિ છો. ભય અને નિરાશાનો એક નાનોસ્થો અંશ પણ તમારી સ્વનામાં મૂક્યો નથી ! આ લો, તમારા અધિકારો સંભાળો !

આ પુસ્તક તમને બતાવશે કે તમે શરીર નથી, છું નથી પણ ઈંવર છો. શરીરની, મનની જેટલી પણ મહાન શક્તિઓ છે એ તમારા હથિયાર છે. ઈન્ડ્રિયોના તમે ગુલામ નથી, ટેવો તમને વિવશ કરી શકતી નથી. માનસિક

વિકારેનું ક્રોછ અસ્તિત્વ જ નથી. પોતાને અને પોતાનાં વાસ્તોને બરાબર ઓળખી લો. પછી જીવનો સ્વાભાવિક ધર્મ તે બધાંનો સાચો ઉપયોગ કરવા લાગશે. દેઢ મનોબળવાળી તત્ત્વજ્ઞાન બુદ્ધિથી દેખ કર્યે કુશળતાથી થઈ રહે છે. આ જ કર્મ કોશલ્ય યોગ છે. ગીતાજી કહે છે, યોગઃ કર્મસુ કોશલમૃતમે એવા જ કુશળ યોગી બનો, લોક્ષિક અને પારસ્પોક્ષિક કાર્યોમાં તમે તમારું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરતાં સફળતા મેળવી રહો અને નિસ્તાર વિકાસ તરફ પધતા રહો. આ સાધનાઓનો ઉદ્દિષ્ટ છે.

ઈવર આપને આ માર્ગ જવા પ્રેરણા આપે.

બીજો અધ્યાય - આત્મદર્શન

આત્માનું જ્ઞાન ભાષણો આપવાથી, દલીલોથી કે માત્ર સાંભળ્યેથી પ્રાપ્ત થતું નથી, એવું શાસ્ત્રોનું કથન છે.

પ્રથમ અધ્યાય સમજી લીધા પણ તમને ઈચ્છા થઈ હોડે એ આત્માના દર્શન કરવાનું જોઈએ જેને જીવા બાદ આ જગતમાં જોવાનું કંઈ બાકી રહેનું નથી. આ ઈચ્છા પણ સ્વાભાવિક જ છે. શરીર અને આત્માનો સંબંધ જ એવો છે કે વધુ વ્યાનથી જોવાથી ઘણી છીક્કો જાણી શકાય છે. શરીર ભૌતિક સ્થૂળ પદાર્થોનું બનેલું છે, પણ આત્મા સૂક્ષ્મ છે. પાણીમાં તેલ રેડીએ તો પણ તેલ ઉપર જ તર્ફી કરો. લાકડાના ટુકડાને તળાવમાં ફાદે નેટલા ઉડી સુધી નાખી આવો, તે ઉપર આવવા જ પ્રયત્ન કરરો, કારણ કે તેલ અને લાકડાના પરમાણું પાણીના પરમાણું કરતાં વધુ સૂક્ષ્મ છે. ગરમી ઉંચે જાય છે. આગની જવાળાઓ ઊંચે ઉઠે છે. પૃથ્વીનું ગુરુત્વાર્થીંશ ન તો તેમને નીચે રેકી રહે છે છે કે ન તો વાયુનું દ્વારા તેમને ઉપર જતાં રેકી રહે છે. શરીરની સરખામાણીએ આત્મા સૂક્ષ્મ છે તેથી તે શરીરમાં બંધાઈ રહેલો હોવા છાં, શરીરમાં જ ઓતપોત થવાને બદલે તે ઉપર ઊંચા જ પ્રયત્ન કરે છે. લોકો ક્રૂદે છે કે ઈન્દ્રિયોનો ભોગ અમને લલચાવે છે, પણ આ વાત સાચી નથી. સત્યના દર્શન કરવાની યોગ્ય સગવડ અને રિક્ષાણ ન હોવાથી માનવી જગ મારી પોતાની આંતરિક તૃપ્તા દિયપવા વિષયભોગોનો કાદવ પીએ છે. જો તેને એક વાર પણ

આત્માનંદનો ચસ્કો લાગી જાય તો તે ગમે ત્યાં ભટકે જ રા માટે ? હું જાણું છું કે, આ લીટીઓ વાંચતાં તમારું મન વિરહમાં ઝૂસો ફિસ્તમ પોતાની પ્રિયતમાના સમાચાર જાણવા ઉત્સુક હોય તેવું ઉત્સુક થઈ રહ્યું છે. આ એક માત્ર એવી ખૂબ જ મજબૂત સાબિતી છે એ કે માનવીની આંતરિક ઈચ્છા આત્મસ્વરૂપ ઓળખવા માટેની જ હોય છે. આત્મા શરીરમાં ખેલા છાં તેની સાથે ઓતપોત થઈ શક્નો નથી, પણ અવાસનવાર પોતાની ક્રોછક ખોવાઈ ગયેલી વસ્તુને શોધતો કરે છે. બસ ગમે ત્યાં ભટક્યા કરે છે, તેને ખબર નથી કે હું શું શોધું છું ? મારું ક્રોછક ખોવાઈ ગયું છે, એવો અનુભવ કરે છે. ખોવાયેલી વસ્તુના અભાવમાં દુઃખી થાય છે પણ માયાજળના પકડા પાછળ દુઃખાયેલી એ વસ્તુ તે જાણી શકતો નથી. મન ધારું ચંચળ છે. સહેજ વાર તે એક જગ્યાએ ચોટું નથી. બધા તેની શરિયાદ તો કરે જ છે પણ મન આટણું ચંચળ કેમ છે ? તે કોઈ જાણી શકતું નથી. તે પોતાની ખોવાયેલી વસ્તુ માટે ઘમાયકી મચાવે છે કસ્તુરી મૃગ કોઈ અદભુત સુગંધ અનુભવી તે મેળવવા હિંસ રાત ભાગ્યા કરે છે, ભાગ્યા જ કરે છે.....કાગનો પણ તેને વિશ્રાબ નથી.....આ જ હાલત મનની છે, જો તે જાણી જાય કે કસ્તુરી મારી નાભિમાં જ રખેલી છે તો તે બધી ચંચળતા છેડી આનંદથી ઝૂમી ઉઠ્યો.

આત્મરદ્ધનનો અર્થ પોતાની સત્તા, શક્તિ અને સાધનોને સાચા સ્વરૂપે ભગજમાં એટલી ગાઢી રીતે આંકી લેવાનાં છે કે હિંસભર, જિંદગીમાં ક્યાસેય તે ભૂલાઈ ન જવાય. પોપટના જેવી ગોખાળપદીમાં તમે હેશિયાર થઈ રહ્યે, છો, આ પુસ્તકમાં આપ્યું છે તેનાથી દશ ગગા જાનનું ભાખાગ તમે આપી શકો છો, અકાય દલીલો તમે કરી શકો છો, શાસ્ત્રોની ભૂલો તમે શોધી શકો છો, પણ આ બધું આત્મ-મહિસા એ દર્શાજ સુધી જ જાય છે. જયાંથી આગળ ક્રાંતા જવું, કઈ રીતે જવું એ તમને ખબર પડી શકતી નથી. પોપટ પંડિત ન થઈ રહે. શાસ્ત્રોએ સ્પષ્ટતા કરી છેકે, આત્માનો ઉપદેશ બુદ્ધિથી કે બહુ સાંભળ વાથી મળી શકતો નથી." હવે જયારે તમે આટણું સાંભળી ચૂક્યા છો ત્યારે મને ખાતરી છે કે તમે કોઈનાથી ભરમાઈ તો નહીં જ જાવ. આજે હું તમારી સાથે કોઈ દલીલો કરતો નથી, જો તમને આ વિષયમાં રસ જાગે અને

આત્મર્દ્ધની ઈચ્છા થાય તો મારી પાસે ચાલ્યા આવો બાકી તમારે અમૂલ્ય સમય વર્થું બગાડો નહીં.

આત્મર્દ્ધની નિસરળી પર ચઢના પહેલાં સૌ પ્રથમ તમે સમનળ જમીન પર આવો. જ્યાં આજે તમે ભટ્ટી રહ્યા છો, ત્યાંથી પાછા આવો અને જ્યાંને પ્રવેશદ્વાર કહે છે ત્યાં સ્થિર થાવ. માની લો કે તમે તમારું બધું જ્ઞાન ભૂલાવી દીધું છો અને નવેસરથી કોઈ પાઠ્યાળામાં દાખલ થઈ બારાખરી શીખી રહ્યા છો. આમાં તમારું અપમાન ન માનો. તમારું અત્યાર સુધીનું જ્ઞાન ખોટું નથી. તમે ઉર્દુ ભાષી હો અને ઉર્દુ ધ્યાન ભાલ્યા હો તો પણ, જો તમે હિંદી ભાષાનો લાભ ઊઠાવવા માગતા હો તો પણ તમે સીધે સીધાં એ હિંદી ભાષામાં લખાયેલાં દર્શનરાસો વાચવા મંડી પડશો નહીં, પણ હિંદી બારાખરી જ શીખવાની શુભ રચનાત્મક કરશો. હું મારા માનનીય અને જ્ઞાની જિજાસુઅંની પીઠ થાબરીને બે ઝડલાં પાછાં છટપાંતું કહું છું કારણ કે તેનાથી પ્રથમ નિસરળી પર પગ રાખી રાખશો અને સરળતાથી જરૂરી ગતિએ ઊચે ચઢવા લાગશો.

તમારે વિચાર કર્યો જોઈએ કે જ્યારે હું કહું છું : “હું” તો એનો શો અર્થ થાય ? પણ પક્ષી તેમ જ અન્ય અવિક્ષિત પ્રાણીઓમાં આ “હું” ની ભાવના હોતી નથી. ભૌતિક સુખ દુઃખનો તો તેઓ અનુભવ કરે છે, પણ પોતાની બાબતમાં કાઈ જ વિચારી શક્તાં નથી. ગફડાને એ ખબર નથી કે મારી પીઠ પર આટલો બધો બોજ રા માટે લાદવામાં આવ્યો છે ? બોજ લાદનાર અને મારે શો છે ? કઈ રીતે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે ?.... આવું કઈ જ ખબર હોતી નથી. તે તો વધારે બોજ લાદાંના દુઃખનો અને ખોરાક માટે લીલું કુમળું ધાસ મળો ત્યારે શાંતિનો, આનંદનો અનુભવ કરે છે, પણ આપણી જેમ તે વિચારી શક્તાં નથી. આ જીવોમાં રારીર જ આત્મા સ્વરૂપ હોય છે. કરસા : પોતાનો વિકાસ કરણાં કરણાં માનવી આગળ વધી ગયો છે. છાં કેટલા માનવીઓ આત્મસ્વરૂપને જાગે છે ? પોપટના જેવી ગોખાળુંદીની વાત અલગ છે. લોકો આત્મજ્ઞાનની ચર્ચા સાંભળી ટેપેઝેર્ડસી જેમ મગજમાં ઠાંસી તો લે છે અને અવાલનાર તેનાં અવતરણો, દાખલા ટંકના હોય છે. આવા માનવીઓ ધર્મા છે. જેઓ આત્માની બાબતે કંઈ જ જાગૃતા

નથી, પણ તેઓનામાં વિચારવાની રાજી જરૂરી ગયેલી છે. તેમનો સંસાર આહાર, નિકાસ, ભર્ય, મૈથુન, ડ્રેધ, લોભ, ભોખ વગેરે સુધી જ મર્યાદિત છે. આ સમસ્યાઓ ઉંલવા વિચારવા તેઓએ યોગ્યતા તો પ્રાપ્ત કરી લીધી છે. મૂઢું માનવી વિષય બોગેથી નૃપ થઈ જાય છે, તો પોતાની જનને બુદ્ધિસાળી ગાળાવનારાઓ તેમાં સુંદરસા લાવવા પ્રયત્ન કરે છે. મજૂરને બળ દ્વારામાં બેસવા મળે તો પોતાનું સૌભાગ્ય સમજે છે તો ધનવાળ મોટરમાં બેસી પોતાની બુદ્ધિ પર ખૂશ થાય છે. વાત એકની એક જ છે. બુદ્ધિનો જે વિકાસ થયો છે તે ભોગ-વિલાસને ઉન્નત અને વધુ આકર્ષક બનાવવામાં જ થયો છે, સમાજના મોટા ભાગના સભ્ય નાગણ્યિ માટે શરીર જ આત્મા છે. મનના સંતોષ ખાતર ધાર્મિક રૂદ્ધિઓ પાળે છે, ચલાતે છે, પણ તેઓને આત્મજ્ઞાન સાથે ક્રોછ જ સંબંધ નથી. દીકરીના લઘુમાં પસ્થિત આપવાને પુઅય કાર્ય સમજે છે, પરંતુ આવાં પુઅય કાર્યો કર્યો માનવી પોતાના નિસ્ચિત લક્ષ સુધી પહોંચે છે ? યજ્ઞ, તપ, જ્ઞાન, લોકજીવન કે સમાજભ્યવસ્થા માટે કસ્તાં રહેવામાં ધર્મ તો છે જ પણ તેનાથી આત્માની પ્રાપ્તિ થઈ શકે નહીં. આત્મા એટલો સૂક્ષ્મ છે કે રૂપિયા, પૈસા, પુત્ર, પુત્રી, દાન, માન, પૂજા, જૈવી બહારની વસ્તુઓ તેના સુધી પહોંચવામાં સંપૂર્ણ અસર્મર્થ છે. પછી આ બધાં દ્વારા આત્મજ્ઞાન કરીતે મેળવી શકાય !

આત્માની પાસે પહોંચવામાં જે સાધનો આપણું પાસે છે તે ચિત્ત, અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરે. આત્મરૂપનાની સાધના આનાથી જ થઈ શકે છે. શરીરમાં બધે જ આત્મા વ્યાપેલો છે. ક્રોછ વિરોધ સ્થાન માટે તેને મોકલ્યો નથી. જે રીતે આત્માની આરાધના કર્ત્વાથી મન, બુદ્ધિ વગેરે સુમુદ્ધ થઈ શકે છે તે રીતે તેનાં સ્થાન અને સ્વરૂપનું દર્શન માનસલોકમાં પ્રવેશ કર્ત્વાથી જ થઈ શકે છે. માનસલોક પણ સ્થૂળ લોકના જેવું જ છે. તેમાં આ બાધા દુનિયાનો પડછાયો જ જોવા મળે છે. હમારાં આપણે કલક્તાનો વિચાર કરતા હોંાં, હવે આપણે હિમાલયના પર્વતની મજા માઝીનીં. હમારાં વિચાર કરતા હોંાં તે સ્થૂળ કલક્તા કે હિમાલય ન હોંાં, પણ માનસપદ પર વ્યાપ્ત તેની છાયા હોની. આ છાયા ખોટી ન હોય. પદાર્થનું સાચું અસ્તિત્વ ન હોય તો

તેની કષ્ટપાન જ ન થઈ શકે. આ માનસ લોકને ભ્રમ ન માનશો. તે એ સૂક્ષ્મ ચેતના છે જેની મહદ્દુથી દુનિયામાં બધાં કાર્યો ચાલે છે. એક દુઃખનદાર પરદેશથી માલ ખરીદવા પરદેશ જવા યોજના ઘડે છે. સૌ પ્રથમ તે પરદેશની યાત્રા પોતાના માનસલોકમાં કરે છે અને માર્ગની અડયારો વિચારી લે છે. આ અડયારો દૂર કર્યાના ઉપાયો પણ શોધી લે છે અને પછી જ સ્થળ દેખે માલ ખરીદવા પરદેશ જાય છે. ઉચ્ચ આધ્યાત્મિક ચેતનાઓ માનસલોકમાંથી આવે છે. કોઈના મનમાં શા ભાવ ઉપજે છે? કોઈ આપણા માટે હું વિચારે છે? આપણો કયો સંબંધી કેવી દ્રાઘામાં છે? વગેરે વાતો માનસલોકમાં પ્રવેશ કરી આપણો ૮૦% જેટલી સાચી રીતે તો જાગ્રતી શકીએ છીએ. આ વાત સાધારણ લોકોના કામકાજની થઈ. લોકો ભવિષ્ય જાગ્રતી લે છે, ભૂતકાળની હાલત બતાવે છે, પરોક્ષ જ્ઞાન રાખે છે, આ બધી ઈશ્વરીય ચેતનાઓ માનસલોકમાં જ આવી જાય છે. આ ચેતનાઓ મહાંગુણ કરી તેને અભ દ્વારા પ્રગટ કર્યામાં આવે છે. જો આ માનસિક ઈન્ડિયો ન હોત તો માનવી ચાલતા ફરતા પૂતળા જેવો, યંત્ર માનવ (રિબોટ) જેવો જ હોત. પાંચ ડિલોગ્રામ માટી અને ૧૦ લિટર પાણીથી બનેલા આ પૂતળાનો આત્મા અને સૂક્ષ્મ જગત સાથે સંબંધ જોડનારી ચેતના એ માનસલોક જ સમજવી જોઈએ.

હવે મારો એ પ્રયત્ન હોડે કે તમે માનસલોકમાં પ્રવેશ કરી આગળ ચાલો અને ત્યાં બુદ્ધિનાં દિવ્ય ચક્ષુઓ દ્વારા આત્માનું દર્શન કરો, તેનો અનુભવ કરો. આ એક જ માર્ગ દુનિયાભરના બધા સાધકોનો માર્ગ છે. તત્ત્વ-દર્શન બુદ્ધિની મહદ્દુથી માનસલોકમાં પ્રવેશ કર્યા બાદ જ થાય છે તે સિવાય અન્ય કોઈ ટૂંકું રસ્તો આજ હિન્દુ સુધી કેંઠેએ શોધી કાઢ્યો નથી. પ્રલ્યાણાર, ધારણા, ધ્યાન અને સમાધિ જ યોગના ઉચ્ચ પગથિયાં છે. આધ્યાત્મિક સાધક-યોગી યમ, નિયમ, આસન, પ્રાણાયામ એમ અનેક પ્રકારની ડિયાઓ કરે છે. હજ યોગી નેતૃ, ધોતિ, બસ્તિ વગેરે પ્રયોગો કરે છે. અન્ય સાધકો બીજાં સાધનોનો આશાયે લે છે. આ બધું સારીએ મુશ્કેલીઓ દૂર કર્યા માટે જ છે. શરીરને તંદુરસ્ત રાખવું એટલા માટે જરૂરી છે કે સ્વાસ્થ્યની તકલીફો માનસિક અલ્યાસમાં અડયારું ન લાવે. હું મારા સાધકોને શરીર સ્વાસ્થ્ય રાખવાનું કહું દું. આજની

પારિસ્થિતિકોમાં શારીરિક કસ્ટોના ક્ષેર પ્રયોગોની નકલ કરવાથી કોઈ ખાસ શયદ્ય નહીં થાય. ધુમાડાથી ઘેરાયેલા રહેણી વાયુમંડળમાં રહેનાર વ્યક્તિને ઉત્ત્ર પ્રાણાયામ કરવાની સલાહ આપવી એ જોઈ છે. કણો અને મેવા ખાઈને પર્વત પ્રેરણની નદીઓનું અમૃત જળ પીનારા અને ઈન્દ્રિય ભોગોથી દૂર રહેનારા સ્વસ્થ સાધકો હુંયોગના જે ક્ષેર વ્યાયામ કરે છે તેની નકલ કરવાનું તમને કહું તો હું પાપમાં પડીશ અને હીક્કનો જાણ્યા વિના એવી શારીરિક ક્ષેરણામાં પડતા સાધકો પેલી દેડ્કીનું ઉદાહરણ બનશે. એક દેડ્કીએ એક ઘોડાને પગે નાળ જડાવતો જોયો. તેને પાગ ઘોડાની જેમ પગે નાળ જડાવવાનું મન થયું નાળ જડાવતાં જ દેડ્કી મરી ગઈ. સ્વસ્થ રહેવાના સામાન્ય નિયમો બધાં જાણે છે. આ નિયમોનું ક્ષેરણાથી પાલન કરવું જોઈએ. જો કોઈ રોગ હોય તો કુરણ ચિકિત્સક પાસે જઈ તેનો ઈલાજ કરાવવો જોઈએ. આ આત્મજ્ઞાનની સાધના માટે કોઈ એવી ખાસ શારીરિક યોગ્યતાની જરૂર નથી. સ્વસ્થ રહે, હ્સતા રહો એટલું જ પૂર્ણ છે.

સારું ! હવે ચાલો સાધના તરફ વળીએ. કોઈ એકાંત સ્થળ શોધો. જ્યાં કોઈ પ્રકારનો ડર અથવા લલચાવનાર આકર્ષણ ન હોય તે સ્થળ ઉત્તમ છે. તદ્દન એકાંત સ્થળ મળે તો તો તે શ્રેષ્ઠ જ છે, પાગ બધે એવું સ્થળ મળવું શક્ય નથી. જેથી શક્ય એટલું નિર્જન, શાંત સ્થંબ શોધવું જોઈએ. આ કામ માટે રોજ નવું સ્થળ બદલવાને બદલે એક જયા નક્કી કરવી ઉત્તમ ગગાય. વન, પર્વત, નદીનો કિનારો વગેરેની સગવડ ન હોય તો સ્વરચ્છ, નાનો ઓરડો આ કામ માટે પસંદ કરો જ્યાં તમારું મન સાધનામાં લાગી જાય. આરામથી બેસો. નાડીઓ પર દબાગ આવે તે રીતે ન બેસો. જિન જરૂરી છાતી કાઢી, ગળું કુલાલી, હથો મરડી કે પગને કસીને એકબીજા પર ચડાવી બેસવાનું નથી. કારણ કે આવી અવસ્થાને લીધી તમારા શરીરને દુઃખ થરો, પીડા થરો અને શરીર વારંવાર આ પીડાની કુરિયાદ મનને જગ્યાલી તેને વિચલિન કરી નાખશે. શરીરને બિલકુલ ઢીલું કરી નાખવું જોઈએ, જેથી માંસપેશીઓ શાંત રહે અને શરીરનો પ્રચ્યેક ભાગ શિથિલતા, શાંતિ અને આરામનો અનુભવ કરે. આ રીતે બેસવા માટે આરામ ખુરશી સારી છે. ખાટલા પર આડા પડવાથી પાગ કામ

ચાલરો. માથું ઊર્યું ટેવવું જરૂરી છે. ઓશીકા અથવા અન્ય ક્રોઝ આધારે દીવાલને સહારે પાગ બેસી રક્ષાય. તમને જે રીતે માફક આવે તે રીતે બેસો, પાગ એ સતત ખ્યાલ રાજો કે શરીર રૂના ઢગલાની કેમ દીખું રહે અને ક્રોઝ પાગ અવયવની સારસંભાળ માટે સહેજેય પ્રયત્ન ન કર્યો પડે. આ અવસ્થામાં જો સમાધિ ચેતના આવવા લાગે તો શરીર ગમે તે બાજુ ઢળી પડે તેવી બીજી ન રહે. આ પ્રકારે બેસી શરીરને આરામ અને મનને શાંતિ અનુભવવા હે. શરૂઆતમાં આ અભ્યાસ ખાસ પ્રયત્નોથી કર્યો પડે છે. પદ્ધી ટેવ પડી જતાં સાધક જ્યારે ઈચ્છે, ત્યારે સાંતિનો અનુભવ કરી રહે છે. પદ્ધી ભલે તે ગમે તે સ્થળો ગમે તેવી અવસ્થામાં કેમ ન હોય. સાવધાન રહો !આ દરાં તમને સ્વભ જોવા માટે કે ક્રંપના જગતમાં ઈચ્છે ત્યાં ઊર્યા માટે બતાવી નથી કે ક્રોઝ ઈન્ફ્રિય વિકાસે આ એકાંત જંગલમાં કંબડી રમવા દેવા પાગ નથી બતાવી. ધ્યાન રાજો ! તમારી આ ધ્યાનાવસ્થાને પાગ નિયંત્રણમાં રખવાની ટેવ પાડવાથી છે જેથી તમે જ્યારે ઈચ્છે ત્યારે આ અવસ્થામાં આવી શકો. આગળ જતાં આ ધ્યાનાવસ્થા ચેતનાનું જ એક અંગ બની જરો, પદ્ધી હમેશાં તેની જીતે જ આવી જરો. તે વખતે તેને ધ્યાન દ્વારા લાવવી નહીં પડે. આના લીધે ભય, દુઃખ, કલેશ, આરાંકા, ચિંતા વગેરેમાં પાગ સાધક અનાયાસે આવી ધ્યાન મુદ્દામાં આવી જતાં દુઃખ કલેશથી બચી જરો.

હાં, તો ઉપરોક્ત ધ્યાનાવસ્થામાં આવી તમારા બધા વિચારેને •હું• પર એકઠા કરો. ક્રોઝ બહારની વસ્તુ કે ક્રોઝ વ્યક્તિ સંબંધે બિલકુલ વિચાર ન કર્યો. ભાવના એવી કરો કે મારો આત્મા હીક્રો એક સ્વતંત્ર પદાર્થ છે, તે અનંત બળવાન, અવિનાશ, અખંડ છે, તે એક સૂર્ય છે જેની આજુબાજુ મારો પોતાનો સંસાર ફરી રહ્યો છે. જેવી રીતે આ સૂર્યિમાં સૂર્યની ચારે બાજુએ નિસ્તર બધા ગણે ફર્યા કરે છે તે રીતે મારો સંસાર મારા આત્માની ચોફેર ફરી રહ્યો છે. પોતાને સૂર્ય જેવું પ્રકારાવાન કેન્દ્ર માનો. પોતાના માનસલોકના આકાશમાં પોતાના આત્માને સૂર્યરૂપ માની કેન્દ્રની જેમ સ્થિર થાવ અને આત્મા સિવાય અન્ય બધી વસ્તુઓનો ગણોની જેમ તમારા આત્માની આજુબાજુ ફરી નિષ્ઠાળો તે બધી મારાથી બધાયેલી છે, હું તેમનાથી બધાયેલો નથી. મારી શક્તિથી હું

આ બધાનું માર્ગદર્શન કરી રહ્યો છું સંચાલન કરી રહ્યો છું છાં તે વસ્તુઓ
મારી નથી કે હું પોતે તે વસ્તુઓ નથી. સતત પરિશ્રમથી, અનુભવથી થોડા
દિવસો બાદ આ ચેતના ટેઢ બનશે.

આ ભાવના પણ જુહી કે કાલ્પનિક નથી. વિશ્વનું દેખ જડ—ચેતન પરમાણુ
બરાબર કર્યો કરે છે. સૂર્યની આસપાસ પૃથ્વી વગેરે ગણો ફરે છે અને સમગ્ર
મંડળ એક અદ્દસ્ય ચેતનાની પરિક્રમા કરે છે. હૃદયની ચેતનાને લીધે લોહી
આપણા શરીરની પરિક્રમા કરે છે. શબ્દ, શક્તિ, વિચાર કે અન્ય પ્રકારનાં ભૌતિક
પરમાણુઓનો ગુણ પરિક્રમા કર્સાં કર્સાં આગળ ધપવાનો છે. આપણી
આજુબાજુ પ્રકૃતિનો આ સ્વાભાવિક ગુણ પોતાનું કામ કરે છે. જે પરમાણુને
આપણી જરૂર હોતે સ્વાભાવિક રીતે આપણી આજુબાજુ ફરશે, કાગળ કે ચેતનાનું
કેન્દ્ર આપણે છીએ. આ બિલકુલ સ્વાભાવિક ચેતનાને હૃદયમાં કડારી લેવાથી
તમને તમારામાં કોઈ વિચિત્ર પરિવર્તન જાગાશે. તમને એવું લાગશે કે ચેતનાનું
કેન્દ્ર હું છું અને મારો સંસાર, મને સંબંધિત ભૌતિક પદ્ધાર્થો બધું મારી આજુબાજુ
ફરી રહ્યું છે. મકાન, કપડાં, ધરેણાં, ધન દ્રોલત બધાં મને સંબંધિત તો છે, મને
લાગે વળગે છે પણ તે મારામાં ધૂસી શક્યાં નથી. મારાથી બિલકુલ અલગ
છે. પોતાને ચેતનાનું કેન્દ્ર માનનારા પોતાને માયાથી સંબંધિત તો માને છે, પણ
પાણીમાં પડેલા કમળના પાનની જેમ સહેજ ઉચ્ચ ઉકેલા રહે છે, તેમાં ઝૂલતા
નથી. પોતે તુચ્છ, અશક્ત અને બંધનવાળો જીવ નથી, પણ ચેતન કેન્દ્ર,
પ્રકારાપુંજ એવું લાગતાં જ તેને અનુરૂપ વસ્તો, અલંકારો મળી જાય છે.
બાળક મોટું થાય છે ત્યારે તેના નાનાં કપડાં ઊઠારી લેવામાં આવે છે. પોતાને
હીન, નીચ અને શરીર અભિમાની તુચ્છ જીવ માનશો, ત્યાં સુધી અને લાયક
જ કપડાં તમને મળશે. લાલચ, ભોગેચ્છા, કામેચ્છા, સ્વાર્થ વગેરે ગુણો તમહારે
પહેલાં જ પડ્યો, પણ જીવારે પોતાના સ્વરૂપને મહાન માનશો તો આ કપડાં
નિર્ણયક બની જરો. નાનું બાળક પહેલેલાં કપડાંમાં જાડો-પેશાબ કલ્યામાં કિર્હ
લાજ શરમ અનુભવતું નથી, પણ એ જ બાળક મોટું થતાં જો ભૂલેચ્યેદ્ય પહેલેલાં
કપડાંમાં જાડો પેશાબ કરી નાખે તો શરમાઈ જાય છે. તેને ધૂળા ઉત્પન્ન થાય
છે. કોઈ બીમારીને લીધે આવું કરે તે બનવા જોગ છે. આમ છાં ય તેને

જીત પર પિકાર થશે. નીચ વિચાર, હીન ભાવનાઓ, પાર્શ્વિક ઈર્ષણો અને સ્વાર્થ એ એવા ગુણ છે જેને જોઈ આત્મ-ચેતનામાં વિકસિત થયેલો માનવી ધૂગુા અનુભવે છે. તેને તેના શરીરને અનુરૂપ ગુણો મળી જ જાય છે. ઉદાસાહ, વિશાળતા, દ્યા, સહાતુભૂતિ વગેરે જ એને લાયક વલો બની રહે છે. દેક્ષો મોટે થતાં જ તેની લાંબી પૂછડી આપોઆપ ખરી જાય છે તેવી રીતે દુર્ઘાસો વિદ્યાય લે છે અને વધોવૃદ્ધ હાથીના દાંતની જેમ સદગુણો ધીમે ધીમે વધ્યા કરે છે.

પોતાને પ્રકારાપુંજ અનુભવવા માત્ર દલીલો કે તર્કથી કામ ન ચાલે કારણ કે આપણી દલીલો આંધળી અને લંગડી હોય છે. જેને આપણે “પિતાજી” કહીને બોલાવીએ છીએ. એ જ આપણા સાચા પિતા છે એવું દલીલોના આધારે સાબિત કરી શકતું નથી. આ માટે યોગાત્માસના દેવી અનુષ્ઠાનમાં આવી દલીલોનો ત્યાગ કર્યો પડે છે અને ધારણા, ધ્યાન અને સમાપ્તિ અપનાવવાં પડે છે. થોડા સમય માટે આ તર્ક દલીલોને વિદ્યાય આપો. વિશ્વાસ રાખો. આ લીટીઓનો દેખક તમને ફ્લાયવા કે ક્રેઝ નુકસાન થાય એવો માર્ગ બતાવતો નથી. તેનો ચોક્કસ વિશ્વાસ છે અને તે સોગાંદપૂર્વક તમને કહે છે કે, “મારા પર વિશ્વાસ રાખનાર સાધક ! આ સાચો રસ્તો છે, મારો જોયેલો રસ્તો છે. આવ, મારી પાદણા પાદણા ચાલ્યો આવ, તને ક્યાંય ધેકેલી નહી દઉ, પાગ એક સાચા સ્થળે પહોંચાડી દઈશ.” ધ્યાનાવસ્તામાં સાધના વારંવાર કરી માનસલોકમાં પ્રવેશ કરો. પોતાને સૂર્ય સમાન પ્રકારમાન સત્તાના રૂપમાં જુઓ અને તમારે સંસાર તમારી આજુભાજુ ફસ્તો નિહાળો. આ અભ્યાસ સતત કરતા રહો અને હૃદય પર પાગ આંકી લો. ઉપરાંત એ શ્રોણીએ પહોંચો જયાં તમે બોલશો : “હું” તો તરસ જ તેની સાથેસાથ મનમાં ચેતના, વિચાર, શક્તિ અને પ્રતિભા સાથેનું કેન્દ્ર સ્વરૂપ ચિત્ર પાગ જાગે, સંસાર પર દીણ્ણ કરો તો તે આત્મસૂર્યની પરિક્રમા કરતો દેખાય.

ઉપરોક્ત આત્મદર્શનમાં સહેજ જરૂપ આવે એ માટે એક બીજી વિધિ બતાવું દુઃ. ધ્યાનની અવસ્થામાં બેસી પોતાના જ નામનો વારંવાર, ધીમે ધીમે ગંભીરસાથી અને સ્વેરછાએ જપ કરો. આ અભ્યાસથી મન આત્મસ્વરૂપ પર

એકાજ થણે. લોઈ ટેનિસલે પોતાની આત્મરાજીનિ આ રીતે જગૃત કરી હતી. તેઓ ધ્યે છે : આ ઉપાયથી મે કર્દું આત્મજ્ઞાન મેળવ્યું છે. પોતાની વાસ્તવિક્ષિતા અને અમરતાને જાગૃતી અને પોતાની ચેતનાના મૂળ સ્વોતનો અનુભવ કરી લીધો છે.

કેટલાક જિજ્ઞાસુઓ આત્મસ્વરૂપનું ધ્યાન કર્સાં કર્સાં “હુ” ને શરીર સાથે જોડી છુટ્ટે ખારગું કરે છે જેને લીધે તેઓની સાધના નિષ્ફળ જ્યા છે. આ મુસીબત દૂર કર્સી જરૂરી છે.

ધ્યાનાપસ્થામાં ભાવના કર્યો કે હું શરીરથી અલગ હું. શરીરનો ઉપયોગ માત્ર વસ્તુ અથવા તો જીવિયાર તરફ કરું હું. શરીરને પહેરવાનાં કપડાં તરફ માનવા પ્રયત્ન કર્યો. અનુભવ કર્યો કે શરીરનો ત્યાગ કર્યા પણ હું “હુ” તો મોજૂદ જ હું. શરીરનો ત્યાગ કર્યા બાદ તેનાથી ઊચા સ્થળોથી શરીરને જોવા પ્રયત્ન કર્યો. શરીરને એક ખાલી માળાના રૂપમાં જુઓ, જેમાંથી તમે સહેલાઈથી આપ જ કરી રહ્યો છો. એવો અનુભવ કર્યો કે શરીરના પેલા ખાલી ખોખાને હું જ સ્વસ્થ, બળવાન, દૃઢ અને ગતિશીલ બનાવું હું. શરીર પર હું જ રાજ્ય કરું હું અને મારી પોતાની ઠરછા અનુસાર તેને ઉપયોગમાં લઈ હું. હું શરીર નથી, તે મારું વસ્તુ જ છે. જેમ ભાડાના ક્રેઝ મજાનમાં આપણે વિશ્રાંમ કર્સાં હોઈએ તેમ આપણે આપણા શરીરમાં વિશ્રાંમ કરીએ ધીએ. એમ માનો, શરીર ભૌતિક પરમાણુઓનું બનેલું છે અને આગુણોને હું જ અક્ષર્ણિત કરી રહ્યો હું. ધ્યાનમાં શરીરને સંપૂર્ણ ભૂલી જાઓ અને “હું” પર સમગ્ર ભાવના ડેન્ફિન કર્યો. ત્યારે તમને ખબર પડ્યો કે આત્મા શરીરથી અલગ છે. આ અનુભવ કરી લીધા બાદ જ્યારે તમે “મારું શરીર” શબ્દો વાપરણો ત્યારે તે અગાઉના કર્સાં ક્રેઝ જૂદા જ અર્થમાં વાપરણા હશ્યો.

આ ભાવનાનો અર્થ એવો નથી કે તમે શરીરની ઉપેક્ષા કર્સાં માંયો. આ તો મહા અનર્થ થણે. શરીરને આત્માનું પવિત્ર મંહિર માનો. તેની હર પ્રકારે સ્થા કર્યો, સ્વસ્થ અને સુંદર બનાવો, એ તો તમારું પરમ કર્યા છે.

શરીરથી અલગ યવાની ભાવના જ્યાં સુધી સાધારણ રહે છે, ત્યાં સુધી સાધુને મનોસ્થન મળે છે, પણ જેવી તે દૃઢ બને છે કે તત્ત્વ જ મૃત્યુ થયા

જેવો અનુભવ થાય છે. અને સાધના સ્થળે બેઠાં બેઠાં ખુલ્લી આંખોએ જે વસ્તુઓ જોઈ શક્ણાં નથી તે વસ્તુઓ દેખારો. સૂક્ષ્મ જગતની ક્રોઈ જલક દેખાય છે, ક્રોઈ પરોક્ષ વાતો દૈવી દેશ્ય દેખાવા માર્ગ છે. આવી સ્થિતિમાં સાધક ગભરાઈ જાય છે. આમાં ડરવા જેવું સહેજેય નથી. સાધનામાં જડપી પ્રગતિ અને ક્રોઈ પૂર્વ સંચિત સંસ્કારોને લીધે આ ચેતનાને સહેજ ઢોળતા તે એક્ષમ જાગૃત થઈ ગઈ છે. આ અવસ્થાએ કુમરાઃ અભ્યાસથી પહોંચીએ ત્યારે ક્રોઈ નવાઈ લાગતી નથી. સાધનાની ઉચ્ચ શ્રેણીએ પહોંચી ક્રોઈ પાગ અભ્યાસીને તે યોગ્યતા મળી જાય છે, જેના વડે તે શરીરથી ઊંડે ઊડી રહે છે અને શરીરમાં રહી જે દેશ્યો જોવાં અશક્ય છે તે બધાં જોઈ રહે છે. આ અવસ્થામાં અભ્યાસી શરીરનો સંબંધ તોડી નાખતો નથી. જેવી રીતે ક્રોઈ ઓરડામાં બેઠેલી વ્યક્તિ બહાર હું ચાલી રહ્યું છે તે જોવા ઓરડાની બારીમાંથી ડેક્કિયુ કરવા પોતાની ડેક લંબાવે છે અને જોઈ લીધા બાદ પોતાની ઈચ્છા મુજબ ડેક અંદર પેંચી દે છે. તે રીતે આ સાધનાનો અભ્યાસી કરી રહે છે. નવા સાધકોને આવો અનુભવ જગાડવા પરવાનગી આપતો નથી. કારણ કે આ તો ઘરાં આગળ વધ્યા બાંદનો અનુભવ છે. ઉચ્ચિત સમય આવશે. ત્યારે હું પરોક્ષ દર્શનનું રિલાય પાગ આપીશ. અહીં તો માત્ર એટલા માટે આનો ઉદ્દેશ કર્યો છે, જેથી ક્રોઈ સ્વંયલૂ આવી ચેતના જાગે તો તેવા વખતે તે ગભરાઈ ન જાય.

જુદુ અમર છે એવું મોટા ભાગના લોકો માને છે. એ લોકોએ એ જાણવું જોઈએ કે આ વાત ક્રોઈ આધાર વિનાની નથી પાગ સાબિત કરી શકાય તેવી છે. તમે ધ્યાનમુદ્રામાં એવી કૃત્યના કરો કે “હું” મરી ગયો. ક્રોષ્ણ સંભળવામાં તો આ વાત સાધારણ જરૂરાય છે. જે સાધકોએ પાછળાં પાનાની વિગતો પ્રમાણે ભાવનાઓનો અભ્યાસ કર્યો છે તેમના માટે આ મરી જવાની કૃત્યના મુશ્કેલ નથી, પાગ જયારે તમે આવું કરવા બેસરો ત્યારે કુદ્દોણો કે તે અવસ્થામાં જવાતું નથી. આવી કૃત્યના કર્ત્વી અસંભવ છે. તમે શરીરના મરી જવાની કૃત્યના કરી રહે છો, પાગ સાથે જ ખબર પડો કે તમારો “હું” મર્યો નથી, પાગ દૂર ઊભો ઊભો મૂત્ર શરીરને જોઈ રહ્યો છે. આ પ્રકારે ખ્યાલ આવશે કે ક્રોઈપાગ રીતે “હું” મરી જવાની કૃત્યના કરી શકાના નથી. વિચારખુલ્દિ જી

પહે છે કે આત્મા મરી રક્તો નથી.. તેને જીવના અમરત્વ પર પૂરો વિશ્વાસ છે અને ગમે તેટલો પ્રયત્ન કરો પણ તે પોતાના અનુભવનો ત્યાગ કર્યા તેથાર નહીં થાય. ક્રેદ આધાત લાગીને કે કલારોજોર્મ સુંધીને બેભાન થઈ જઈએ તો પણ “હું” તો જગૃત જ રહે છે. જો આમ ન થતું હેત તો જગૃતાવસ્થામાં આવતાં જ તેને કેમ ખબર પડી જાય છે કે પોતે કેટલો સમય નેહોશ રહ્યો ? બેભાનવસ્થા કે નિદ્રાની કલ્પના થઈ શકે છે, પણ જ્યારે “હું”ના મોતની વાત આવે છે ત્યારે ચારે બાજુઓથી તેના અસ્વીકારનો પડ્યો જ પડ્યા કરે છે. આ કેટલા આનંદની વાત છેકે જીવ પોતાના અંડાં અને અમૃતવની સાંજિની આપણી અંદર જ સુદૃઢ રીતે ધારણ કરી બેઠો છે.

પોતાને અમર, અંડા, અવિનાશી અને ભૌતિક લાગણીઓથી અવિચિત્ત સમજવું-એ આત્મદર્શનનું જરૂરી પાસું છે. આની અનુભૂતિ કર્યા વિના સાચ્યો આત્મવિશ્વાસ થતો નથી અને જીવ પોતાની લાંબા કાળથી ઈચ્છિક તુચ્છાથી ભૌય પર પટકાઈ પડે છે, અભ્યાસનો બધો પ્રયત્ન ધૂળમાં મળી જાય છે. એટલા માટે એકાગ્રતાપૂર્વક સાચ્યી રીતે અનુભવ કરો કે હું અવિનાશી હું. આ અનુભવ બરાબર ન કરી શકે ત્યાં સુધી આગળ ના વધો, થોડા આગળ વધો કે તત્ત્વ જ તમારા સ્વરૂપની ફરીથી પરીક્ષા લો. આ ભાવના આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં ધ્યાણી મહેદૃષ્ટાપ છે.

ધ્યાનાવસ્થામાં આત્મસ્વરૂપને શરીરથી અલગ કરો અને ક્રમશઃ તેને આકાશ, હવા, અભિનિપાણી અને પૃથ્વીની પરીકામાંથી સઝણતાપૂર્વક બહાર નીકળતો જુઓ. કલ્પના કરોકે મારા શરીરની જંગ્ટ છૂટી ગઈ છે અને હું સ્વતંત્ર થઈ ગયો હું. હેતે તમે આકાશમાં ઈરદ્ધાપૂર્વક પક્ષીની જેમ ઊંચે નીચે જ્યાં ઈચ્છે ત્યાં ઊડી શકો છો. હવાના વેગથી તમારી ગતિમાં ક્રેદ અવરોધ આવતો નથી અને હવાના અભાવે જીવ જોખમમાં પણ મૂક્ષાતો નથી. કલ્પના કરોકે ધ્યાણ વીવ અગ્નજવાળા સળગી રહી છે અને તમે તેમાંથી છસતા મોંએ પસાર થઈ જાઓ છો. જીવને આગ કઈ રીતે સળગાવી શકે? આગની ગરમી તો માત્ર શરીરને ઈજ પહોંચાડી શકે છે. આ રીતે પાણી અને પૃથ્વીની અંદર પણ જીવ પહોંચી શકે છે. ક્રેદ સત્ત્વ તમને સ્પર્શી રક્તનું નથી અને તમારી સ્વતંત્રતામાં સહેજ

પાગ અડયાગ પેદા કરતું નથી.

આ ભાવનાથી આત્માનું સ્થાન શરીરથી માત્ર ઉચ્ચે જ ઉક્તાનું નથી, પાગ શરીરને પ્રભાવિત કરતાં પંચ મહાભૂત-પંચ તત્ત્વથી ઉચ્ચે ઉઠે છે. જીવ જીબે કે હું દેહ નથી, પાગ દેહના નિર્માતા પંચતત્ત્વથી પાગ પર હું અનુભવની આ ચેતનામાં પ્રવેશ કરતાં તમને ખાતરી થશે કે તમારો નવો જન્મ થયો છે. નવીન શક્તિનો સંચાર તમારી અંદર થતો ઘ્યાલ આવશે. હવે એવો વિશ્વાસ થશે કે જે વસ્તુઓથી અત્યાર સુધી હું ર્થાનું હશે, તે વસ્તુઓ મને ઝરવી રક્ખતી નથી. તે બધાનો પ્રભાવ માત્ર શરીર સુધી છે. જ્ઞાન અને ઈરણશક્તિ દ્વારા શરીર માટેનો આ ભય પાગ દૂર કરી રક્ષાય છે.

વારંવાર સમજી લો. પ્રાથમિક શિક્ષાણનો બીજમંત્ર ‘હું’ છે. આનો પૂર્ણ અનુભવ કરી લીધા પછી જ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ ધરી શકશો. તમારે અનુભવ કરવો પડશો કે તમારી સત્તા શરીરથી અલગ છે. પોતાને સૂર્ય સમાન શક્તિનું એક વિરાટ કેન્દ્ર જેની આજુબાજુ તમારો સંસાર ધૂમી રહ્યો છે તે જીએઓ. આનાથી નવીન શક્તિ આવશે, જેનો અનુભવ તમારી નણકનાં બધાં જ કરી શકશો. તમે જ્ઞાતે સ્વીકાર કરવો કે હવે હું સુદૃઢ થઈ ગયો હું અને જીવનની આંધીઓ મને વિચલિત કરી શકતી નથી, કંઈ એટલું જ નહીં, આનાથી પાગ આગળ વધી શકશો. પોતાની આમિક ઉન્નતિ દ્વારા તમે જીવનની એ આંધીઓને રાંત કરી શકશો અને તેના પર તમારી છુંભત, તમારું રાજ્ય પાગ સ્થાપી શકશો.

આત્મજ્ઞાની દુનિયાનાં ભયાનક દુઃખો વચ્ચે પાગ હસતો રહે છે અને એ દુઃખોનો આનંદ માણગો દુઃખોને કહેશે : “જીએઓ, યાત્યાં જાવ, જે અંધકારમાંથી તમે ઉત્પન્ન થયાં છો તેમાં વિલીન થઈ જાવ.” ધન્ય છે તે સાધક જેણે ‘હું’ ના બીજમંત્રની સિક્ષિ મેળવી લીધેલી છે.

જિજ્ઞાસુઓ ! શરૂઆતના આ શિક્ષાણનો અભ્યાસ કરવા હવે મારાથી વિઝૂટા પડી જાય. પ્રગતિ ધીમી લાગે તો જ્ઞાનન કરશો આગળ ધરવામાં ડા પાછાં પડે તો નિરાશ ન થશો. આગળ જતાં તમને બમાગો લાભ મળશે. સિક્ષિ અને સફળતા તમારા માટે છે, તે તમને મળવાની જ છે. વધો,

શાંતિ સાથે યોગે પ્રયત્ન કરો.

: ચાદ રાખો :

- હું રહ્મનિ અને ભૂતિલાનું તેનું હું.
- હું વિચાર અને સબજાનિનું તેનું હું.
- મારે સંસાર મારી બારે બાજુ શ્રી રૂપો છે.
- હું શરીરથી અલગ હું.
- હું અવિનારણી હું. મારે નાચ થઈ શકે નહીં.
- હું અખંડ હું. મારું કરું જ બગરી શકે નહીં.

ત્રીજો અધ્યાય

શરીરથી ઈન્દ્રિયો સૂક્ષ્મ છે, ઈન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે અને મનથી સૂક્ષ્મ આત્મા છે. આત્મા સુધી પહોંચવા ધીમે ધીમે જા માંડવા પડ્યો. પાઠ્યા અધ્યાયમાં આત્માને શરીર અને ઈન્દ્રિયોથી પર અનુભવવાનું સાધન બતાવ્યું હતું. આ અધ્યાયમાં મનનું સ્વરૂપ સમજવા અને આત્માને તેનાથી અલગ સાબિત કરવાનો મારો પ્રયત્ન રહેશે. પાચીન દર્શનશાસ્ત્ર મન અને બુદ્ધિને અલગ અલગ માને છે. આધુનિક દર્શનશાસ્ત્રો મનને જ સર્વોચ્ચ ક્ષાળાની બુદ્ધિ માને છે. આ વિવાદમાં તમારે ખાસ પડવા જેવું નથી. બનેનો મતસેદ એટલો નજીવો છે કે ઉપરથિતી નજીરે બધું એકનું એક જ લાગે છે. બને પ્રકાસાં શાસ્ત્રો મનને સ્થૂળ અને બુદ્ધિને સૂક્ષ્મ માને છે. સાધકોની સંગ્રહ માટે બુદ્ધિને મનની ઉચ્ચ કેટિમાં ગ્રાણાંનું હું અને આગળ તેનો અલ્યાસ કરાનું હું.

અધ્યાર સુધી તમે જ્ઞાની લીધું છે કે આપણાં લૌટિક આપણાં, વસ્તો ક્યાં ક્યાં છે? હવે આ પાઠમાં એ બતાવવાનો પ્રયત્ન કરું હું કે અસહી અહમ „હું“ થી એટલો જુદ્ધો છે. આ સૂક્ષ્મ પરીક્ષા છે. લૌટિક આપણાંનો અનુભવ જેટલી સહેલાઈથી કરી શકાય છે એટલી સહેલાઈથી સૂક્ષ્મ શરીરમાંથી આપણા વાસ્તવિક અહમને છૂટે પાડવો મુશ્કેલ છે. આના માટે કુંક વધુ યોગ્યતા અને ઉચ્ચ ક્ષાળાની ચેતના જોઈએ. લૌટિક પદ્ધારોથી જુદ્ધ થવાનો અનુભવ થયા બાદ પણ „અહમ“ સાથે બેળસેળ થઈ ગ્રહિતું સૂક્ષ્મ શરીર ગ્રંથવાડી જીબા

કરે છે કેટલાય લોકો મનને આત્મા સમજે છે. આગળ ઉપર હું મનની વાખ્યા તો નહીં કરું પણ એવો ઉપાય બતાવીશ જેનાથી સ્થૂળ શરીર અને ‘હું’ ના ટુકડે ટુકડા કરી શકો અને તેમાંથી ‘અહમ’ કેને કષેવાય તે શોધી શકો. તેમાં અલગ અલગ વસ્તુઓ કઈ કઈ છે એ તમે મન દ્વારા સમજી શકશો. તમે આના માટે મનને મજબૂર કરી શકો છો કે તે તમારા આ પ્રશ્નોના સાચા જવાબ આપે.

શરીર અને આત્મા વચ્ચેની ચેતના મન છે. સાધકોની સગવડ માટે હું મનને ત્રાણ વિભાગમાં વહેચું હું : પ્રવૃત્ત મન, પ્રલુદ મન અને સર્વોચ્ચ મન.

પ્રવૃત્ત મન-પણું પહી વગેરે અવિકસીત છુંબો અને માનવીમાં સમાનરૂપે ક્રામ કરું જોવા મળે છે. આને ગૃહન અથવા સુખુપન મન પણ કહે છે. શરીરને સ્વાભાવિક જીવન ચલાવ્યે રાખવું એ એનું ક્રામ છે. આપણી જીત વિના પણ ક્ષરીનો ધ્યો આપોઆપ ચાલ્યા કરે છે. ભોજનની પાચનજીવા ચાલ્યા કરે છે, લોહીનું પરિભ્રમણ થયા કરે છે; લોહી, માંસ, ચરણી, હાડ્ઝાં, વીર્ય વગેરે બન્યા કરે છે; મળત્યાગ, શ્વાસ, ઉચ્છ્વાસ, પાંપણો ખૂલવી-બંધ થવી વગેરે કર્યો આપોઆપ થયા કરે છે. ટેવો પડી જવાનું ક્રામ પણ આ મન દ્વારા જ થાય છે. આ મન મોઝેથી ક્રોછ વાતને પદ્ધતી લે છે, પણ જેને તે પકડે છે તેને સહેલાઈથી છોડું નથી. આપણા પૂર્ણજોના અનુભવ અને આપણો પણ જીવનમાંથી ઉચ્ચ ક્ષાએ પછોચતાં સુધીનો અનુભવ આ મનમાં જ જમા થાય છે. મનુષ્ય એક અલપલુંક સામાન્ય પ્રાણી હતું . તે વખતે તેનામાં ઈર્ષ્યા, દ્વષ, અધડાની વૃત્તિ, સ્વાર્થ, ચિનતા વગેરે સામાન્ય વૃત્તિઓ આ મનના ખૂગામાં પડી રહી હતી. પાછલા અનેક જન્મોનો નીચ સ્વભાવ જે ખાસ પ્રયત્નોથી દૂર કરાયો નથી તે બધું આ મનમાં જમા છે. આ એક અદ્ભુત અજ્ઞાયબ ઘર છે. જેમાં બધી જ જીતની વસ્તુઓ જમા છે. કેટલીક સારી અને અમૂલ્ય વાતો છે તો કેટલીક સરેલી, ગંઢી બાબતો પણ છે. જંગલી માનવી, પણ અને દુષ્ટોમાં જે લોલ, ડિસા, ફૂસા, આવેશ, અધીરાઈ હોય છે તે પણ સુધ્મ રીતે આ મનમાં જમા છે. એ વાત અલગ છે કે કેટલાક માનવી ઉચ્ચ મન દ્વારા આ વૃત્તિઓને અંકુશમાં રાખે છે. રજુસુ અને તમસુ વૃત્તિઓ આ મન સાથે જ સંબંધ ધરાવે છે. ઈન્ડિયોનો ભોગ અભિમાન, ક્રેષ, ભૂજ, તરસ્સ, કામેચ્છા, નિદ્રા વગેરે આ “પ્રવૃત્ત મન”

નાં જ રૂપ છે.

“પ્રવૃત્ત મન” થી ઉચ્ચો મનનો બીજો વિભાગ છે. જેને પ્રબુદ્ધ મન કહેવાય છે. આ પુસ્તક વાંચતા તમે આ પ્રબુદ્ધ મનનો જ ઉપયોગ કરી રહ્યા છો. મનના આ ભાગનું કામ વિચારણ, વિવેચન, તુલના, કટ્યના, દલીલબાળ, નિર્ણય, હાજરજવાબીપાણું, બુધ્યમના, ચતુરતા, અનુભવ, પરીક્ષાગ વગેરે છે એ યાદ રાખો. જેવી રીતે “પ્રવૃત્ત મન” એ અહમ નથી, તેવી જ રીતે “પ્રબુદ્ધ મન” પણ અહમ નથી. થોડી વાર વિચાર કરી તમે સહેલાઈથી “પ્રબુદ્ધ મન” ને અહમથી અલગ પાડી શકો. આ નાના પુસ્તકમાં બુદ્ધિના ગુણધમોનું વિવેચન ન થઈ શકે. આ વિષયમાં વિરોષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનોવિજ્ઞાનના શ્રેષ્ઠ ગ્રંથોનું અધ્યયન કરી શકે છે.

મનનો ત્રીજો અને અતિ મહત્વનો વિભાગ સર્વોચ્ચ મન છે જેને “અધ્યાત્મ મન” કહે છે. અનો વિકાસ મોટા ભાગના લોકોમાં થયો હોયો નથી. મને લાગે છે કે તમારામાં આ “અધ્યાત્મ મન” થોડું થોડું વિકસી રહ્યું છે અને એટલા માટે આ પુસ્તક ધારા રસથી વાંચી રહ્યા છો, તેમ જ તેમાં આપેલી વિગતો, માહિતી અંગે રસ દાખલો છો. મનના આ ભાગને આપાગે ઉત્થતમ, શ્રેષ્ઠ ભાગ ગારીએ અને આધ્યાત્મિકતા, આનંપ્રેરણ, ઈશ્વરીય સેદ્ધા, પ્રતિભા વગેરે ગારી શકીએ. ઉત્થ ભાવનાઓ મનના આ ભાગમાં ઉત્પન્ન થઈ ચેતનામાં પહોંચે છે. પ્રેમ, સહાનુભૂતિ, ધ્યાન, કલ્યાણ, ન્યાય, નિષ્ઠા, ઊદાસીં, ધર્મપ્રવૃત્તિ, સત્ય, પવિત્રતા, આત્મીયતા વગેરે ભાવનાઓ આ મનમાંથી આવે છે. ઈશ્વરની ભક્તિ પણ અહોથી જ ઉદ્ભવે છે. ગૃહ તત્ત્વોનું રહસ્ય આ મન દ્વારા જ ખૂલે છે.આ પાઠમાં જે સ્પષ્ટ “અહમ”ની અનુભૂતિના શિક્ષાગનો પ્રયત્ન હું કહી રહ્યો છું તે આ “અધ્યાત્મ મન”ના ચેતના ક્ષેત્રથી પ્રાપ્ત થાય છે, પણ એ ભૂલો નહીં, મનનો આ સર્વોચ્ચ ભાગ પણ એક વસ્ત્ર સમાન જ છે, “અધ્યાત્મ મન” પણ અહમ નથી.

તમારે એ શંકા ન લાવવી જોઈએ કે હું કોઈ મનની નિદા અને કોઈની સુનિ કરી રહ્યો છું અને ચિંતા ઉભી કરાયું છું. વાત આવી નથી. બધાં આવું જ વિચારે છે કે મનની મદ્દથી જ તમે તમારી વાસ્તવિક સત્તા અને આત્મજ્ઞાન

સુધી પહોંચા છે અને આગળ પણ તેની સહાયતાથી જ તમારો માનસિક વિકાસ કરી શકશો. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મનનો દેખ ભાગ તેની રીતે ખૂબ જ સારો છે.

સાપારગું લોકો હજુ સુધી મનના નીચલા ભાગોનો જ ઉપયોગ કરે છે. તેઓના માનસલોકમાં હજુથ એવાં અસંખ્ય ગુપ્ત સ્થળ છે, જેની સ્વભન્માં પણ કૃત્પના થઈ શકી નથી તેથી ક્ષોલસાથી વર્તવાને બદલે ટેટલાક તત્ત્વજ્ઞાનીઓ સાધકુને આ ગુપ્ત શક્તિને ડિયાશીલ બનાવવા માટેનો ઉપદેશ આપે છે.

રિકાગું જે તમને આપવામાં આવી રહ્યું છે તે મન દ્વારા જ સમજી શકાય, ધારગું કરી શકાય અને મન દ્વારા જ સફળતા મેળવી શકાય એવું છે. એટલા માટે જ હું સીધેસીધો તમારા મન સાથે વાતો કરી રહ્યો હું કે “હે મહોદ્ય ! તમારી ઉચ્ચ ક્ષાયાથેથી આવતા જ્ઞાનને ગ્રહણ કરે અને તેના પ્રવેશ માટે તમારા દરવાજા ખોलી દો.” હું મારી બુદ્ધિથી પ્રાર્થના કરું હું કે, ભગવતી તમારું ધ્યાન એ મહાત્ત્વ પર લગાવો અને સત્યનાં અનુભવી મા તમારા આધ્યાત્મિક મન દ્વારા મળનારી દૈવી ચેતના સરળ બનાવો.

અભ્યાસ

સુખ અને શાંતિપૂર્વક ઉચ્ચ મનની ઉચ્ચતમ ક્ષા દ્વારા આપને મળનારા દ્વિજ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યેના આદર સાથે બેસો.

પાછલા પાઠમાં તમને મે સમજાવ્યું હતું ‘હું’ શરીરથી અલગ ક્રેઝક માનસિક વસ્તુ છે જેમાં વિચાર, ભાવના અને વૃત્તિઓ ભરેલી છે. હવે તેનાથી આગળ વધવાનું છે અને અનુભવ કરવાનો છે કે આ વિચારા યોગ્ય વસ્તુઓ આન્માથી અલગ છે.

વિચાર કરે કે કોણ, દ્રોષ, મમતા, ઈર્ષા, ધૂગાંદુનની વગેરે અસંખ્ય ભાવનાઓ મગજમાં આવ્યા કરે છે તેમાંથી તમે જુદી પાડી શકો છો, તપાસી શકો છો, વિચારી શકો છો, તોડી શકો છો. આ ભાવનાઓનો ઉદ્ય, વેગ અને અંત પણ સમજી શકો છો. યોડા દ્વિસના અભ્યાસથી પોતાના વિચારોની પરીક્ષા કરવાનો એવો અભ્યાસ મેળવી લેશો કે જાગે તમે તમારા ક્રેઝ ભિત્રની

ભાવનાઓના ઉદ્ય, વેગ અને અંતનું પરીક્ષાગું કરી રહ્યા છે. આ બધી ભાવનાઓને તમારા ચિંતન કેન્દ્રમાં મળશે. તેના સ્વરૂપનો અનુભવ કરી શકે છે, તેને ગજોરી શકે છે, હયમચાવીને જોઈ શકે છે. અનુભવ કરો કે આ ભાવનાઓને તમે નથી. આ ફક્ત એવી વસ્તુઓ છે જે તમે મનના યેતામાં ભરી શર્યા કરે શકે છો. જે તેનો ત્યાગ કરી આત્મસ્વરૂપની કૃત્યના કરો. આવી ભાવના સરળતાથી કરી શકશો.

આ માનસિક વસ્તુઓને અલગ કરી તમે તેના પર વિચાર કરી રહ્યા છો. એનાથી એ સાબિત થાય છે કે તે વસ્તુઓને તમારાથી અલગ છે. અલગ કરવાની ભાવના ધીમે ધીમે અભ્યાસથી સતત વધતી જરો અને દોષટે એક મહાન આકારમાં પરિગમશે.

એવું ના વિચારણો કે હું શિક્ષાગ દ્વારા એ બનાવી રહ્યો હું કે ભાવનાઓનો ડેવી રીતે ત્યાગ કરશો. જો તમે આ શિક્ષાગની મદ્દથી દૃષ્ટિઓને ત્યાગવાની જરૂરત મેળવી શકે તો ઘણા આનંદની વાત છે, પણ એ હું માનતો નથી, હું તો અત્યારે એ સલાહ આપવા માંગું હુંકે તમારી સારી-નરસી વૃત્તિઓન્યાં ને ત્યાં રહેવા છે અને એવો અનુભવ કરો કે “અહમ” આ બધાંથી અલગ છે. સ્વતંત્ર છે. જ્યારે તમે “અહમ” ના મહાન સ્વરૂપનો અનુભવ કરી લો ત્યારે પાછા વળો અને જે વૃત્તિઓ અત્યાર સુધી તમને ગુલામીમાં જડકી રાખતી હતી તે હેઠે જાતે તમારી ગુલામ બની રહી છે. તમે તેના માલિક બની યોગ્ય ઉપયોગ કરો. પોતાની વૃત્તિઓને “અહમ”થી અલગ પાડવાના અનુભવમાં તમે ગબડી પડે તો પણ ગભરણો નહીં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ફરી પાછ આવશો, ત્યારે તેમાંથી સારી વૃત્તિઓને ઠંઢાનુસાર ઉપયોગમાં લઈ શકશો. અમુક વૃત્તિએ મને ખાસ બાંધી રાખ્યો છે, હું તેનાથી કઈ રીતે દૂરી રહું? આવી ચિંતા ન કરશો. આ વસ્તુઓ બહારની છે. તેના બંધનમાં બંધાતા પહેલાં “અહમ” હતો અને પછી પણ “અહમ” છે. જો પોતાને અલગ પાડી તમે તેનું પરીક્ષાગ કરી શકતા હો તો તેને એક જ જાટે અલગ પાડી કેંદ્રી ન શકો? ધ્યાનમાં લેવા જેવી એ વાત છે કે તમે એ વાતોનો અનુભવ કરી રહ્યા છો કે “હું” બુઝિ અને આ શક્તિઓનો ઉપયોગ કરી રહ્યો હું. આ શક્તિઓને

વસ્ત કે ઓજાર માનું છું. મનનો સ્વામી ‘અહમ્’ છે. ઉચ્ચ આધ્યાત્મિક મનમાંથી અવેલી પ્રેરણા પાગ આ પ્રકારે શીખી રણય છે. તે માટે તેને પાગ અહમથી અલગ માનવી પડ્યો. તમે શંકા કરશો કે ઉચ્ચ આધ્યાત્મિક પ્રેરણા આ રીતે ન વાપરી રણય, તેથી સંભવ છે કે તે પ્રેરણા ‘અહમ્’ કઈ રીતે છોઈ રહે? હાલ હું આ વાતે છોઈ ચર્ચા કરવા માગતો નથી, કરશું કે તમે આધ્યાત્મિક મનની થોડી જાગુકારી બાદ કરતાં હજુ તે સંબંધે કંઈ જ જાગતા નથી. સાધારણ મનની સરખામાર્ગીએ આ મન ઈષ્ઠપરીય ભૂમિકા સમાન છે. જે તત્વદર્શાઓએ અહમ્ જ્યોતિનો સાક્ષાત્કાર કર્યો છે અને જેઓ પ્રગતિની ઊચામાં ઊચી હ સુધી પહોંચી ગયા છે તે યોગીઓ કહે છે : “અહમ્ આધ્યાત્મિક મનથી ઉપર રહે છ અને અહમ્ પોતાની જ્યોતિથી આધ્યાત્મિક મનને પ્રકાશિત કરે છે.” જેવી રીતે પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ સૂર્ય જેવું જ દેખાય છે, પણ સિદ્ધ સાધકોનો એવો અનુભવ છે કે તે માત્ર જાણી છી છે. ચમકું આધ્યાત્મિક મન જે પ્રતિબિંબ હોય તો “ અહમ્” અંડ જ્યોતિ છે, જે આ ઊચા મનમાં ઉત્પન્ન થતો આત્મિક પ્રકારા મેળવે છે અને તેથી જ તે પ્રકારામાન લાગે છે. આવી અવસ્થામાં તેને ‘અહમ્’ માની લેવાની ભૂલ થઈ જાય છે. હીકણે તે ‘અહમ્’ શાશ્વત પ્રકારામાન એક પ્રકારામાર્ગિ છે, જે કપડાના ટુકડાથી લપેટાયેલો છોઈ પોતાનો પ્રકારા બધાર લાવી રહ્યો નથી. આ કપડા જેમ જેમ હટે છે તેમ તેમ પ્રકારા અધિક સ્પષ્ટ થતો દેખાય છે. છાં પાગ કપડા હટે કે ઢ્કાયેલો રહે તેનાથી ભાગિના સ્વરૂપમાં છોઈ દેખાર થતો નથી.

આ ચેતનામાં લઈ જવાનો એટલો જ હેતુ છે કે ‘અહમ્’ ની સર્વોચ્ચ ભાવનામાં જાગી તમે એક ઉન્નત આત્મા બની જાવ અને તમારાં આ વસ્તોનો સાચો ઉપયોગ કરવા લાગો. જે જૂનાં બિનજરૂરી, શાંતી ગયેલાં વસ્તો છે તેને જારી હેડી રહ્યો અને નવીન તેમ જ અદ્ભુત ઓજારો ઉઠાવી તે વડે તમારી સામેનાં કાયોને સરળતાથી. ઉમંગથી પૂરાં કરી રાખો, પોતાને સર્જણ અને વિજેતા બનાવી રહ્યો.

આટલો અભ્યાસ અને અનુભવ કરી લીધા બાદ તમે પૂછશો કે હવે શું બાકી રહ્યું. જેને ‘અહમ્’ થી અલગ ન ગણો? આવા જવાબમાં હું કોણ છું?

એટલું જ કહેવાનું છે : વિશુદ્ધ આત્મા. એની સાબિતી એ છે કે પોતાના “અહમ” ને શરીર મન વગેરે પોતાની વસ્તુઓથી અલગ કરવા પ્રયત્ન કર્યે. નાની ચીજોથી માંડી, તેનાથી સૂક્ષ્મ, સૂક્ષ્મથીય સૂક્ષ્મ, તેનાથી અલગ વસ્તુઓ છેઝાં છેઝાં વિશુદ્ધ આત્મા સુધી પહોંચી શકરો. શું હજુથી તેનાથી પણ અલગ કર્યું છે ? ... કશું જ નહીં. વિચાર કરનાર, પરીક્ષા લેનાર અને પરીક્ષાની વસ્તુઓ એક જ ન હોઈ શકે. સૂર્ય પોતાનાં કિરણો પોતાની ઉપર જ ચમકાવી શકે ખરો ? તમે વિચારવાની તે પરીક્ષાની વસ્તુ નથી, ઘાં તમારી ચેતના કરે છે. “હું છું” - આ જ આત્માના અસ્તિત્વનો પુરાવો છે. પોતાની કલ્પનારાંકિ, સ્વતંત્રતા શક્તિનો ઉપયોગ કરી આ “અહમ”ને અલગ પાડવાનો પ્રયત્ન કર્યે, ઘાંય હારી જરો અને તેનાથી આગળ નહીં જઈ શકે, પોતાને તમે મૃત્યુ પામેલો નહીં માની રહ્યો. આ વિશુદ્ધ આત્મા અવિનારી, અવિકારી, ઈશ્વરીય સમુક્તનું બિંદુ પરમાત્માનું કિરણ છે.

હે સાધક ! તારા આત્માનો અનુભવ મેળવવામાં સફળ થા અને સમજ કે તું સૂતેલો દેવતા છે. પોતાની અંદર કુદસની એક મહાન સત્તા દ્વારાયેતી છે જે બંધાયેલા હાથે તારી આજાની રાહ જોઈ રહી છે. આ સ્થાન સુધી પહોંચતા થોડે સમય લાગરો. પ્રથમ પગથિયું ચક્કાં પારું થોડી વાર લાગરો, પારું આધ્યાત્મિક વિકાસની ચેતનામાં પ્રવેશ કરતાં જ આંખો ખૂલ્યી જરો. આગળનું એક એક ડગ સ્પષ્ટ થરો અને પ્રકાશ પ્રગટ થતો જરો.

આ પુસ્તકના આગલા અધ્યાયમાં હું બતાવીશ કે વિશુદ્ધ આત્મા પારું સ્વતંત્ર નથી. તે પરમાત્માનો એક અંશ છે અને પરમાત્મામાં કઈ રીતે ઓત-પ્રોત થઈ રહ્યો છે. આ જ્ઞાન મેળવતાં પહેલાં તારે તારી અંદર ‘અહમ’ ની ચેતના જગાડવી પડરો. મારા આ શિક્ષાને માત્ર રાખ્યે સમજી તેની ઉપેક્ષા ન કરીશ. એક માભૂતી વ્યાખ્યા સમજી તેનો અનાદર કે તિરસ્કાર ન કરીશ. આ એક ખૂલ્યું જ સુધી વાત બતાવી રહ્યો છું. તારો આત્મા આ લીટીઓ વાંચતાં. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિના માર્ગ તરફ આગળ વધવા ઉતાવળો થઈ રહ્યો છે તેને યોગ્ય માર્ગદર્શિન આપ અને આગળ ક્રમ ઊઠાવ.

અત્યાર સુધી બતાવેલી માનસિક કસ્સતોનો અભ્યાસ કરી લીધા પછી

‘અહમ’થી અલગ પદાર્�ોનો તને ખ્યાલ આવી જરો. આ સત્યને પ્રાપ્ત કર્યા બાદ પોતાને તું મન અને વૃત્તિઓનો માલિક સમજવા લાગીશ, ત્યારે આ બધી ચીજો પૂરી શક્તિ અને પ્રભાવ સાચે કામમાં લગાડવું સામર્થ્ય મેળવીશ.

આ મહાન તત્ત્વની વ્યાખ્યામાં મારા આ વિચારો અને રણ ભડોળ ઉણ્ણા ઉત્તરેલા લાગરો; સસના, ઓછા અને નિભ સત્તસના લાગરો, કારણ કે આ વિષયનું વિવેચન થઈ રહે એવું નથી. વાણીની ગતિ ત્યાં સુધી પહોંચતી નથી. ગોળની મીઠારા જીબના શબ્દોથી કઈ રીતે સમજાવાય? મારો પ્રયત્ન માત્ર એટલો છે કે તું ખ્યાલ અને રસ જગાડી આ માનસિક કસ્સોમાં લાગી જા, તેનો અભ્યાસ કરવા માંડ. આવું કરવાથી મન વાસનિકાનું પ્રમાણ મેળવતું જરો અને આભસ્વરૂપમાં દેઢ થતું જરો. જ્યાં સુધી જતે અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાન એ જ્ઞાન નથી. એક વાર સત્યનું દર્શાન થરો, તો પછી તે ઘણ્ણિ બહાર જરો નહીં અને તને જોટી દલીલો કરવાનું મન પણ નહીં થાય.

હેઠે તારે પોતાને ગુલામ નહીં, માલિક માનવો પડ્યો. તું રાજી છે અને મન તારું નોકર છે. મન દ્વારા જે અત્યાચારો અત્યાર સુધી તારા પર થયા છે તે બધાને એક જાટે હેડી હે અને તેનાથી મુક્ત થયેલો સમજ. તને આજે રાજ્ય સિંહાસન સોપવામાં આવી રહ્યું છે. દેબ્લાપૂર્વક આજા આપ કે સ્વભાવ, વિચાર, સંકલ્પ, બુદ્ધિ, કામનાઓ બધાં કર્મચારીઓ તારા શાસનનો સ્વીકાર કરે અને નવા મૈત્રી-કરાર પર સહી સિક્કા કરે કે અમે બધાં વશાદાર નોકરોની જેમ અમારા રાજીની આજા માનીશું અને રાજ્યના બદ્ધિબસ્તને સર્વોચ્ચ અને સુંદર બનાવવામાં સહેજેય પાછી પાની કરીશું નહીં.

લોકો સમજે છે કે અમને અમારા મને એવી સ્થિતિમાં નાખી દીધા છે કે અમારી વૃત્તિઓ અમને ખરાબ રીતે ઉકરડામાં, કાંટા જાંખરાંમાં ટસડી જાય છે અને જાતજીતની વેદના આપી દુઃખી બનાવે છે. સાધક આ દુઃખોથી છુટકરો મેળવરો, કારણ કે તે આ બધાંથી પરિચિત છે અને પરિચિત પર કાબુ મેળવવાની યોગ્યતા તોણે મેળવી લીધી છે. ક્રેદ મોટી મિલ હોય, જેમાં સેકડો હોર્સ પાવરવાળું એજિન અને તેમના વડે ચાલતાં સેકડો વિરાટકાય મશીનો અને અસંખ્ય નાના મોટા ભાગો કોઈ પણ અજાણ્યાને ડરાવી શકે છે. અજાણ્યો માનવી.

આવી જગ્યાએ જતાં જ ગલરાઈ જરો કે ક્યાંક ક્રેઝ મશીનમાં લાખ પગ પેસી ગયા તો નાહજના ઉપાધિમાં મુકાઈ જઈયું પાણ, પેલો એજિનીયર કે બધી યંત્ર સામગ્રી સંપૂર્ણપણે જાગે છે. એજિન ચલાવવાના, નિયત્રણમાં વેવાના બધા સિદ્ધાંત સમજે છે તે કારખાનામાં પ્રવેશનાં સહેજ પાણ ગલરાનો નથી અને રૂઘાબ સાથે આ રાખસ છેવાં લાગતાં મરીનો પર હાથીના મહાકાળ કેવી કે સાપના મદારીની જેમ છૂમત જમાવરો. આટલા મોટા કારખાનાની જીવાબદી દેતાં અને ડર નહીં પાણ ગૌર્બ થશે. તે પ્રસન્નતાપૂર્વક સાંજે મિલ માલિકને હિસાબ આપરો કે થોડા સમયમાં જ શ્રેષ્ઠ કાનો માલ કેટલો તૈયાર કરી દીધો છે. તેની ગજ ગજ ફૂલેલી છાતી પરથી જાગે સફળતાનો ગર્વ ટી રોંગ્રે દેખ એવું લાગે છે. જેને પોતાના ‘અહમ’ અને વૃત્તિઓને સંપૂર્ણપણે જાણી દીધાં છે તે આવો જ બાહેર એજિનીયર છે. વધારે દિવસોના અભ્યાસ અદ્ભુત રાજી આપે છે. જાગૃત મન જ નહીં, તે સમયે પ્રવૃત્ત મન, ગુપ્ત મન પણ અભ્યાસી થઈ ગયું હોય છે અને તે જે આજા મેળવે છે તે મુજબ અજ્ઞાતનાં પાણ ચૂપચાપ વર્ત્યા કરેછે. ગુપ્ત મન જ્યારે આ બધાં કાર્યો પૂરાં કરી સામે મુક્કે છે ત્યારે નવો સાધક યોકી ઊઠે છે કે આ અદ્દરય સહાયતાથી બન્યું છે, આ દૈવી ચયત્કારથી જ બન્યું છે પાણ યોગીઓ જાગે છે કે, આ તમારી અજ્ઞાતી યોગ્યતા છે. જેનાથી અનેકગાણી પ્રતિભા હજુ તમારામાં સુખુન પડેલી છે.

સંતોષ અને પૈર્થ રાખો ! કામ મુકેલ તો છે જ પાણ તેના પછી જે સફળતા મળશે તેનો લાભ ધર્યો વધારે છે. જો તમે તમારું, પદ, સત્તા, મહત્વ, ગૌર્બ, રાજીની ચેતના વગેરે વર્ણના ક્રોર અભ્યાસ, મનનથી મેળવી રજે તો પાણ તમારે તે મેળવવાં જ જોઈએ. જો તમે આ વિચારોમાં મારી સાથે સંમત હો તો ક્ષણ આ પુસ્તક વાંચીને જ સંતોષ ન માનરો. અધ્યયન કરો, મનન કરો, આશા રાખો. સાહસ કરો અને ગંભીરસાથી આ સાધના પથ પર ચાલવા માડો.

આ પાઈના મુખ્ય મુદ્દા

– ‘હું’ સત્તા દ્યું મન મારે પ્રગટ થવાનું વલ છે.

- ‘હું’ મનથી અલગ હું તેનો આશ્રિત નથી.
- ‘હું’ મનનો ગુલામ નથી, માલિક હું.
- ‘હું’ બુદ્ધિ, સ્વભાવ, ઈચ્છા અને અન્ય માનसિક વખતે મારી ઈચ્છાથી ત્યાગી રહું હું. ઉતારી રહું હું. તેના પદ્ધી કરી રહે છે તે ‘હું’ હું.
- ‘હું’ અજરાયમર, અવિકારી અને એકરસ હું.
- ‘હું’ હું.

ચોથો અધ્યાય - આત્મા અને પરમાત્મા

સંસારમાં જે કરી છે તે બધું જ ઈચ્છર સાથે ઓતપોત છે.

પાછળા અધ્યાયોમાં આત્મસ્વરૂપ અને તેના આવરણોથી જિજાસુને માહિતગાર કર્યાનો પ્રયત્ન કર્યો છે. આ અધ્યાયમાં આત્મા અને પરમાત્માનો સુંબંધ બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યાર સુધી જિજાસુ સાધક ‘અહમ્’ નું જે રૂપ સમજી રહ્યો છે તે રૂપ હીકેને તો તેનાથી ધારું મહાન છે. વિશ્વવ્યાપી આત્મા, પરમાત્મા, મહાન તત્ત્વ, પરમેષ્યસ્તો અંશ માત્ર છે, તેમાં કોઈ જ બેદ નથી.

તમારે હવે એવો અનુભવ કર્યો જોઈએ કે “હું” જેટલો સમજતો હો, તેના કસાં ‘હું’ ધારું જ વિશ્વાળ હું. ‘અહમ્’ ની મર્યાદાઓ સમસ્ત જ્ઞાનાંના ધોડા સુધી પહોંચે છે. તે પરમાત્મા રાજીની સત્તામાં સમાયેલો છે અને તેમાંથી, જેવી રીતે માતાના પેટમાંથી ગર્ભસ્થ શિરૂ પોણાં મેળવે છે તે રીતે ‘અહમ્’ પોણાં મેળવે છે તે પરમાત્માનું નિજ તત્ત્વ છે. તારે આત્મા અને પરમાત્માની એકત્તાનો અનુભવ કર્યો પડ્યો અને ધીમે ધીમે તારા ‘અહમ્’ને વિસ્તારી ધારું મહાન બનાવવાનો અભ્યાસ કર્યો પડ્યો. તું આમ કરીશ તો જ એ ચેતનામાં તું જાગી જઈશ, જ્યાં પહોંચી યોગીઓ કરે છે:

“ સોહમ્ ” (હું તે હું)

આપ, હવે આ નવો અભ્યાસ શરૂ કરાતું પોતાની ચારે બાજુ સુધી નજીર ફેલાવ અને અંતઃચક્ષુથી જેટલે દૂર સુધીના પાણ્યો જોઈ શકે તેટલા જોવા પ્રયત્ન કર. તને ઘ્યાલ આપશો કે એક મહાન વિશ્વ ચારે બાજુ ધારું દર દર

સુધી કેલાયેલું પડ્યું છે. સામાન્ય રીતે તું જાગે છે તેવું વિશેષ નહીં પણ ચેતનાનો અફાટ સાગર હોય તેવું વિશેષ પ્રયોગ પરમાણુ આકાશ અને ઈંચર તત્ત્વમાં નિરંતર ગતિ કરતો આગળ વધે છે. શરીરનું તત્ત્વ હર ઘડીએ બદ્ધલાયા કરે છે. આજે જે રાસાયનિક પદાર્�ો એક વનસ્પતિમાં છે તે કાલે ભોજન દ્વારા આપણા શરીરમાં પહોંચે. બીજે દિવસે મળાડે બહાર નીકળી અન્ય જીવોના શરીરનું અંગ બની જરો. ડેક્ટરો કહે છે કે, શારીરિક કોષ દર ઘડીએ બદ્ધલાયા કરે છે. જૂના નાશ પામે છે નવા બનતા જાય છે. બાબુ દેખાવમાં શરીર જેવું ને તેવું જ રહે છે પણ થોડા સમયમાં ને બિલકુલ બદ્ધલાઈ જાય છે અને તે કાન્દે જૂના શરીરનો એક ક્રાગ પણ બાકી રહેણો નથી. વાયુ, જળ અને ભોજન દ્વારા નવીન પદાર્થ શરીરમાં પ્રવેશ કરે છે અને શ્વાસ તેમ જ મળામૃત ત્યાં દ્વારા બહાર નીકળી જાય છે. ભૌતિક પદાર્થ પોતાના નિયમ પ્રમાણે કાઢ કરે છે. નહીના તળિયે બેઠેલા કાચબાના શરીર પરથી નવી જળધારા વદ્ધા કરે છે. છાં કાચબો માત્ર એવું અનુભવે છે કે પાણીએ મને ઘેરી રાખ્યો છે. તું પાણીમાં પડેલો દું આપણે પણ આ નિરંતર વહેણી કુરસની ધારાથી જોઈએ તેટલા માહિલગાર હોતા નથી. છાં એક પળ પણ થોખ્યા વિના બરાબર કુરસની ધારા વદ્ધા જ કરે છે. આ ધારા માનવીના શરીર સુધી જ નહીં, પણ બીજા જીવો, વનસ્પતિ અને જેને આપણે જડ માનીએ છીએ તે પદાર્થોમાંથી, પણ પસાર થઈ એ ધારા આગળ વધ્યા કરે છે. દેખે ચીજ હર ઘડી બદ્ધલાઈ રહી છે. તમે મને તેટલો પ્રવાહન કરો, પણ આ પ્રવાહનું એક ટીપું સુદૂં એક કાગ માટે પણ તમે રોકી રક્તા નથી. આ ભૌતિક સત્ય અધ્યાત્મિક સત્ય પણ છે. ક્રીંગ એટલા માટે તો કહે છે : “આ દુનિયા ‘આવન જાપન’ છે.”

ભૌતિક દ્રવ્ય પ્રવાહ તમે સમજુ ગયા હશ્યો, આ વાત માનસિક ચેતનાને પણ લાગુ પડે છે. વિચારધારા, શબ્દાવલિ, સંકલ્પ વગેરેનો પ્રવાહ પણ એ રીતે ચાલુ રહે છે. જે વાતો એક જાળ વિચારે છે તે જ વાત બીજાના મનમાં ઉઠવા લાગે છે. દુરાચારીઓના અંતનું વાતાવરણ એટલું તો ધૂગા ઉપજાવનારું હોય છે કે ત્યાં જતાં જતાં માનવીનો દમ ધૂટાય છે. શબ્દધારા હવે વૈજ્ઞાનિક યંત્રોના નિયંત્રણમાં આવી ગઈ છે. રેડિયો, ટેલિશેન, વાયરલેસ વગેરે શાબ્દ તરણોનું જ

પ્રમાણ મગજમાં આવતા જતા વિચારેનાં હવે ચિંત્રો લેવાય છે. જેનાથી ખબર પડે કે માનવી કેવા વિચારે ગ્રહણ કરી રહ્યો છે, કેવા વિચારે છેડી રહ્યો છે. વાદળોની જેમ વિચાર પ્રવાહ આકાશમાં વધ્યા કરે છે અને માનવીની આકર્ષક શક્તિ દ્વારા જેચાઈ રહે છે યા તો ફેકાઈ રહે છે. આ વિજ્ઞાન ધ્યાન મહત્વનું છે, ધ્યાન વિસ્તૃત છે જેનું વાર્ણન આ નાના પુસ્તકમાં કરતું શક્ય નથી.

મનનાં ત્રણેય અંગો : પ્રવૃત્ત મન, પ્રભુદ્ધ મન અને આધ્યાત્મિક મન પાગ પોતાના સ્વતંત્ર પ્રવાહ છોડે છે એટલે કે આત્માને બાદ કરતાં બાકીનાં બધાં સારીઓ, માનસિક, પરમાણુ ગતિશીલ છે. આ બધી વસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝર્યા કરે છે. જેમ શરીરનાં જૂનાં તત્ત્વો અગળ વધી જાય છે અને નવાં આવે છે તેનું જ માનસિક પદાર્થોની બાબતમાં પાગ સમજતું જોઈએ. એક દિવસ તમારો નિશ્ચય હજોકે આછુંન બ્રહ્મચારી રહીશ અને આજે વિષય ભોગથી સહેજ પાગ ધરાતા નથી. તે દિવસે નિશ્ચય કરેલો કે અમુક વ્યક્તિનું ખૂન કરી નાભીશ, આજે તેના જિગરી ઘોસ્ત બની બેઠા છો. તે દિવસે કહી રહ્યા હતા કે કોઈ પાગ રીતે ધન મેળવવું જોઈએ. આજે બધું છેડી સંન્યાસી બની રહ્યા છો. એવાં અસંખ્ય પરિવર્તનો થયાં કરે છે. શા માટે ? એટલા માટે કે જૂના વિચારો જતા રહ્યા અને નવા વિચારો આવી ગયા.

વિશ્વની દૈસ્ય અદૈસ્ય બધી વસ્તુઓની ગતિશીલતાની ધારણા, અનુભૂતિ અને નિષ્ઠા એવો વિશ્વાસ કરાવે છે કે સંપૂર્ણ સંસાર એક છે. એકતાના આધાર પર તેનું નિર્માણ થયેલું છે. મારી પોતાની વસ્તુ કર્દી નથી અથવા તો આ સમગ્ર વસ્તુઓ મારી છે. નદીના પસમસતા વહેણ વચ્ચે તમને જીભા રાખી પૂછ્યામાં આવે કે પાણીના ટેટલા અને ક્રયા ક્રયા પરમાણુ તમારા છે ? ત્યારે તમે વિચારણે કે પાણીની ધારા બરાબર વહી રહી છે. પાણીના જે પરમાણુ આ સમયે મારા શરીરને સ્પર્શી રહ્યા છે તે આંખના પલકારામાં ક્રયાંના ક્રયાં વહી જરો. જળધારા બરાબર મને સ્પર્શાને જઈ રહી છે એટલે કાં તો સંપૂર્ણ જળધારાને મારી ગણાવું કે મારું કઈ જ નથી એમ ગણાવું ?

આ સંસાર જીવન અને શક્તિનો સમુક છે. જીવ એમાં રહીને પોતાના વિકાસ માટે આગળ વધે છે અને પોતાની જરૂર મુજબની વસ્તુઓ અપનાવે

છે યા તો છેડી હે છે. કુદસ જીવંત હે. જેને આપણે ભૌતક પદ્ધર્થ કહીએ છીએ. તેના બધાં પરમાળું જીવંત હે. તે બધાં શક્તિથી ઉત્તેજિત થઈ ચાદે હે, વિચારે હે અને જીવે હે. આ જીવંત સમુદ્રની સતાને લીધે જ આપણે બધાં ગતિરીલ છીએ. એક જ તળાવનાં આપણે બધાં માછલાં છીએ. વિશ્વવ્યાપી શક્તિ ચેતના અને જીવનનાં પરમાળું વિલિન ચિંતકેને જ્યુગાન્ગ્રાવી રહ્યાં હે.

ઉપરોક્ત અનુભૂતિ આત્માનાં વસ્તો અને સાધનોના વિસ્તાર માટે પૂર્ણી હે. આપણે વિચારણ જોઈએ કે આ બધાં જ મારું શરીર હે. આ બધાંમાં અને મારા શરીરમાં એક જ ચેતના ઓતપ્રોત થઈ રહી હું. જે ભૌતિક વસ્તુઓ સુધી તમે તમારાપણું મર્યાદિત રાખી રહ્યા હે. તેનાથી હવે ધરો દૂર આગળ વધવાનું હે. અને વિચારણાનું હુંકે, "આ વિશ્વ સાગરનાં અમુક જ ટીપાં મારાં હે એ મનનો ભ્રમ હે. હું આટલાં મોટાં વષ્ટ પહેરી રહ્યો હું. જેનાં પાલવમાં સમગ્ર સંસાર ઢંક્યેલો હે." આ આત્મશરીરનો વિસ્તાર હે. તેનો અનુભવે તમને એ ક્ષાએ લઈ જરે, જ્યાં પહેંચેલો માનવી યોગી ક્રેચાય હે. ભજવણ ગીતા કહે હે : સર્વવ્યાપી અનંત ચેતનામાં એકનાના ભાગથી ર્ખેનારું આત્માવાળો તેમ જ બધાનું સમભાવથી જોનારો યોગી આત્માને સંપૂર્ણ પદ્ધર્થોમાં અને બધા પદ્ધર્થને આત્મામાં જુયે હે.

આપણાં વસ્તોનો વિસ્તાર સંપૂર્ણ જીવોનાં બાબુ સ્વરૂપોમાં આત્મીયતાનો અનુભવ કરે હે. આત્માની આત્માઓમાં આત્મીયતા તો હે જ. આ બધાં એકબીજા સાથે પરમાત્મા સતા દ્વારા બંધાયેલાં હે. આ એકના જ ઈંદ્રજિતી બિલકુલ નજીક હે. અહીં આપણે પરમાત્માના દસ્થારમાં પ્રવેશ મેળવતાને પાત્ર અને પરમાત્મામાં વિલીન થવાને યોગ્ય બની જઈએ છીએ. આ અવસ્થા વર્ગાવી શક્ય તેવી નથી. અવર્ગનીય આનંદની ચેતનામાં પ્રવેશ કર્યો એ સમાપ્તિ હે અને તેનું ચોક્કસ પરિગ્રામ આજાઈ, સ્વાતંત્ર્ય, સ્વરાજ્ય, મુક્તિ અને મેળા હે.

એકતાનો અનુભવ કરવાનો અભ્યાસ

ધ્યાન મુદ્રામાં આવી ભૌતિક જીવનપ્રવાહ પર ધ્યાન ધરો અનુભવ કરો કે સમસ્ત બધાઓમાં એક જ ચેતના શક્તિ વહી રહી હું હે અને તેમાંથી જ પાંચ તત્ત્વો બનેલાં હે. ઈન્દ્રજિતો દ્વારા જે અલગ અલગ સુખદુખના અનુભવ

થાય છે તે આ તત્વોની જુદી જુદી રસાયણિક પ્રક્રિયા છે, જે ઈન્ડ્રિયોના તારે સાથે ટકરાઈ અલગ અલગ પરિસ્થિતિઓ અનુસાર ઝંકાર ઉત્પન્ન કરે છે. બધા લોકોનું મૂળ તત્ત્વ એક જ છે અને બીજાની જેમ હું તેમાંથી ગતિ મેળવી શોધું. આ એક કામળી છે જેમા લપેટાઈ આપણે બધાં બાળકો બેઠા છીએ. આ સત્ય હીક્કને સારી રીતે કૃત્પનામાં લાવો, બુદ્ધિ આ સિથ્યનિનો બરાબર અનુભવ કરો, સમજે અને હૃદયમાં ઊઠારી લો.

સ્થૂળ ભૌતિક પદાર્થોની એકનાનો અનુભવ કર્યા બાદ સૂક્ષ્મ માનસિક તત્ત્વની એકનાની કૃત્પના કરો. તે પાણ ભૌતિક દ્વયની જેમ એક જ તત્ત્વ છે અને તમારું મન એક વિરાટ મનનું એક ટીપું માત્ર છે. જે જ્ઞાન અને વિચાર મગજમાં ભેરેલાં છે તે હીક્કને બધે જ વાપન જ્ઞાન અને વિચારધારણા થોડાંક પરમાણુ માત્ર છે અને તેમને પુસ્તકો દ્વારા, ગુરુમુખેથી કે આકાશમાં વહેતી ઈથર ધારાથી પ્રાપ્ત કર્યા છે. આ પાણ એક અખંડ ગતિમાન શક્તિ છે અને તેનો ઉપયોગ કાયબાની જેમ કરીએ છીએ. નહીને તળીએ પડેલો કાયબો અવિરત ગતિએ વહેતા નહીના જીણમાંથી થોડું પાણી પીએ છે અને પછી તેમાં જ મુત્ર રૂપે ત્યાગ કરી દે છે. તેવી રીતે તમે કરી રહ્યા છો. આ સત્યને હૃદયમાં પચાણો અને મગજમાં સ્વપ્ન રીતે આડી લો.

પોતાનાં શારીરિક અને માનસિક વસ્તોના વિસ્તારની ભાવના દૃઢ થતાં જ સંસાર તમારે અને તમે સંસારના બની જરૂરો, ક્રેદ વસ્તુ પરાઈ નહીં લાગે. આ બધું જ મારું છે અને મારું આમાંનું કંઈ જ નથી. એ બે વાક્યોમાં તમને કાઈ ઇચ્છ નહીં લાગે. વસ્તોની ઉપર આત્માને જુઓ, આત્મા નિત્ય, અખંડ, અમર, અપરિર્વતનરીત અને એકરસ છે. તે જડ, અવિર્ભવિત, નીચ પ્રાણીઓ, તારદ ગર્ભો, બ્રહ્માદેને પ્રસંનાતાથી અને આત્મીયતાથી જુઓ છે. પાછે, તિરસ્કારને પાત્ર કે ધૂગાને પાત્ર, છાતીએ લગાડવાને પાત્ર ક્રેદ પદાર્થ ને જોતો નથી, પોતાનું ઘર અને પહોંચોના માળામાં તેને ક્રેદ ઇચ્છ લાગતો નથી.આવી ઉચ્ચ ક્ષાંચે પહોંચી જવું એ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ અથવા પરમાત્માને માટે જ નહીં પાણ સંસારિક લાલ માટે પાણ જરૂરી છે. ઊચાઈના આ સિખરે પહોંચી માનવી સંસારના સાચા રૂપને ઓળખી રહે છે અને તેવી પરિસ્થિતિઓમાં કેની સાથે કેવો વ્યવહાર કરવો ને પાણ જાણી રહે છે. સદગુરોનો ખજનો રોધવો પડો નથી. ઉચ્ચ જિયાઓ, કુરાળત, સદાચાર શીખવાં પડાં નથી, પાણ ઇક્ષું આ હું ક્રેશ હું?

જ વસ્તુ તેની પાસે બાકી રહી જાય છે અને જીવનને દુઃખી બનાવનારે ભરાલ સ્વભાવ ક્યાંનો ક્યાંય નાસી જાય છે.

અહીં પહોંચેલો માનવી સ્વિધપ્રકા બની જાય છે. તે જુદે છે કે બધા અવિનારી આત્માઓ અત્યારે જો કે સ્વતંત્ર, તેજ સ્વરૂપ અને ગતિવાળ દેખાય છે તે બધાંની મૂળ સત્તા એક જ છે. અલગ અલગ ઘડાઓમાં એક જ આકાશ તત્ત્વ ભરેલું છે અને જળપાત્રોમાં એક જ સૂર્યનું પ્રતિબિંબ જગડી રહ્યું છે. જોકે બાળકનું શરીર અલગ છે છાંસાં તેના બધા જ અવયવો તેના મા-બાપના અંગથી જ બનેલા છે. આત્મા સત્ત્ય છે, પણ તેની સત્ત્યતા પરમેષ્ઠિર છે. વિશુદ્ધ અને મુક્ત આત્મા પરમાત્મા છે. આટલે પહોંચી જીવ કહે છે. “ સોહમસ્ત્મિ ” એટલે કે તે પરમાત્મા હું હું . તેને અનુભૂતિ થઈ જાય છે કે સંસારના બધાં સ્વરૂપોની નિયે એક જીવન, એક બળ, એક સત્તા, એક જીવન દ્યુપાયેલી છે.

સાધકોને ચેતનામાં જાગૃત થવા વારંવાર અપીલ કરું દું કારણ કે “ હું હું હું ? આ સત્ત્યતાનું જ્ઞાન મેળવતું એ સાચું જ્ઞાન છે. જોંણે સાચું જ્ઞાન મેળવી લીધું છે. તેનું જીવન પ્રેમ, દ્યા, કલ્યાણ, સહાનુભૂતિ, સત્ત્ય અને ઉદારતાથી ભર્યું હોયું જોઈએ. રોખયાત્તીની કંપના કે પોપટિયા, ગોખળપતી કે પોથી-પાઠ્યી રોં લાલ મળી રહે ? સાચી સહાનુભૂતિ જ સાચું જ્ઞાન છે અને સાચા જ્ઞાનની પરીક્ષા જીવન વ્યવહારમાં તેને જીતાવામાં જ હોઈ રહે. ”

આ પાઠના મુદ્રા

- મારી ભૌતિક વસ્તુઓ એક મહાન ભૌતિક તત્ત્વની જલક માત્ર છે.
- મારી માનસિક વસ્તુઓ એક અખંડ માનસ તત્ત્વનો અંશ માત્ર છે.
- ભૌતિક અને માનસિક તત્ત્વ નિર્વિધે વહી રહ્યા છે નેથી મારી વસ્તુઓને ક્રોઝ જ બંધન નથી. સમુસ્ત બહાનાડાની વસ્તુઓ મારી છે.
- અવિનારી આત્મા પરમાત્માનો જ અંશ છે અને વિશુદ્ધ રૂપમાં આત્મા પરમાત્મા જ છે.

- હું વિશુદ્ધ થઈ ગયો હું પરમાત્મા અને આત્માની એકજાનો અનુભવ કરી રહ્યો હું :

“ સોહમસ્ત્મિ - હું તે હું. ”